

505-508, TEN/11, Beside Mardia Plaza, C.G. Road, Ahmedabad - 9. Ph.: 079-26440303/0505, 48990505/0606 Telefax : 079-26406810 www.shrenik.co.in • e-mail : info@shrenik.co.in CIN No.: L51396GJ2012PLC073061

### SHRENIK/SEC/FY2021-22/06

7<sup>th</sup> May, 2021

To, The National Stock Exchange of India Limited, Exchange Plaza, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400 051, Maharashtra, India.

**Company Symbol: SHRENIK** 

Dear Sir/Madam,

#### Newspaper Advertisement of Intimation of Board meeting to be held on 13th May, 2021 Sub:

Pursuant to Regulation 29 read with regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement in One (1) English - Business Standard and One (1) Regional Language Newspaper - Gujarati - Financial Express about Notice of Board meeting to be held on 13<sup>th</sup> May, 2021.

Kindly take the same on your records.

Thanking you. **Yours Faithfully** 

For SHRENIK LIMITED

**RISHIT VIMAWALA** WHOLE-TIME DIRECTOR (DIN: 03474249)

Encl.: As above



: Wholesale Distributors :

Ballarpur Industries Ltd. 🥱 APP Asia Pulp & Paper 🔼 TNPL Tamilnadu Newsprint & Papers Ltd.

N R Agarwal Industries Ltd. APRIL<sup>®</sup> April Fine Paper Trading Pte. Ltd. O NAINI

Shrenik 🚥

Shrenik Limited CIN: L51396GJ2012PLC073061 Registered Office: 505-508, TEI/11, Beside Mardia Piaza, C.G. Road, Ahmedabad - 380 009, Gujarat. Tel: (079) 26400303 Telefax: (079) 26406810 Email: cs@shrenik.co.in Website: www.shrenik.co.in

NOTICE

NOTICE Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Thursday, 13° May, 2021 to inter-alia, consider and approve Audited Financial Results and Statements of the Company quarter and year ended on 31<sup>st</sup> March, 2021 and other such business matters. The said notice may be accessed on the Company's website at <u>www.shenik.co.in</u> and on the website of National Stock Exchange at <u>www.nseindia.com</u>. For Shrenik Limited

The Bank of Baroda invites offers for premises on lease basis from the owners

The premises shall be ready for occupation or likely to be ready for occupation within period of 1 month. The intending offerers shall submit their offers in two separate sealed cover superscribed "Technical Bid" and "Price Bid" to "The Regional Manager, Bank of

Baroda, Banaskantha Regional Office, 3rd Floor, Rudra Arcade, Nr Aroma Circle, Palanpur 385001, Tel - 02742-296000" on or before 29.05.2021 upto 3.00 PM. Last

date may be increased due to ongoing lockdown. Priority would be given to the premises belonging to Public Sector Units / Govt. Departments. For change in last date and other details please log in on tender section of our web site

The Bank reserves its right to accept or reject any offer without assigning reasons thereof

for the respective branches, with all facilities including adequate power supply :-

Sd/

Rishit Vimawala Whole Time Director

**BANASKANTHA REGION** 

ith minimum carpet area as mentioned below

**Tender Notice: Requires Premises on Lease** 

Space required

1100 to 1725 sq ft

DIN: 03474249

**Regional Head** 



Reconstruction Of Financial Assets and Enforcement Of Security Interest Act, 2002 (hereinafter referred to as the act)

Sale Of secured immovable / moveable assets under the Securitization and MEGAE-AUCTION SALE NOTICE

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES (APPENDIX- IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]) E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis for recovery of below mentioned account/s. The details of Borrower/s/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below

#### Date & Time of E-Auction of following Properties : 28.05.2021 (S.R. NO. 1) & Dt. : 15.06.2021 (S.R. NO. 2 & 3). 02.00 PM to 06.00 PM Inspection Date & Time of following Properties : 27.05.2021 (S.R. NO. 1) & Dt. : 14.06.2021 (S.R. NO. 2 & 3), 11.00 AM to 03.00 PM

L											
I	Sr/ Lot No.	Name & address of Borrower/s / Guarantor/s	Giveshort Description of the Immovable Property with known Encumbrances, if any	Total Dues as per Notice u/s 13(2) of SARFAESI Act, 2002	Reserve Price, EMD	Possession (Symbolic /Physical)	Authorized Officer & Mobile No.				
		Aji Bhaktinagar Branch, Swastik Sales	Commercial Office No. 409 at 4th floor of Jimmy Tower situated Opposite Swaminarayan Gurukul, Gondal Road, Nr. Jain Chal Overbridge, Rajkot, Tal. : Rajkot, Dist. : Rajkot . in name of Beenaben Kiritbhai Mithani. Area 332.00 Sq. Ft.	Dt. 07.02.2018 & Rs. 26,56,941 + unapplied Int. + other charges - Recovery	Reserve Price : 5,80,341 EMD : 58,034	Physical	Pankaj Kumar 91529 40889				
	171	Jagnath Plot (e-Dena) Branch Shyam Trading Co	Shop on 1st floor of East North admeasuring 188.91 Sq. Mts. And open terrace on southern side admeasuring 381.82 Sq. Mts. And 2nd Floor North West terrace admeasuring 201.46 Sq. Mts. of Aghat rights of Plots No. 3 paike (Old Plot No. 2) Village : Shapar, Revenue Survey No. 28 & 298 Paiki, Tal. : Kotdasangani, Dist. : Rajkot, Gujarat Standing in the name of Shri Bhaveshbhai Tulshibhai Togadiya and Shri Jitendrabhai Popatbhai Bhalara	Dt. 24.09.2019 & Rs. 2,07,22,983.02 + Unapplied Int. + Other Charges - Recovery	Reserve Price : 65,16,321 EMD : 6,51,633	Physical	Mr. Manjit Kumar Tiwary 96876 96003				
3       Gondal E-Dena Branch, Payal Oil Industries       Residential House at Village Amamagar Old Gamtal, Lekh No. 39, Dt. 07.06.1933, Lekh No. 2-1933 and Lekh No. 11-2004, Dt. 01.02.1948 paikee, Residential House, Admeasuring 266.91 Sq. Mtrs. situated within the village limit of Amamagar, Sub Dist. : Jetpur, Dist. : Rajkot in the name of Ratibhai Bachubhai Kotadiya.       Dt. 09.05.2016 & Residential House at Village Amamagar Old Gamtal, Lekh No. 39, Dt. 07.06.1933, Lekh No. 2-1933 and Lekh No. 11-2004, Dt. Rs.1,62,70,796.20 + Unapplied Int. + Other Charges - Recovery       Physical EMD : 1,73,500											
	Bidder registration, submission & verification of KYC documents and transfer of EMD in wallet must be completed well in advance at least two days before auction date. In case Auction purchaser submits the KYC documents within two days preceding the Auction date, Authorized officer / Bank / e- Auction service provider is having liberty to accept and complete the KYC verification & EMD amount. However in such event the Authorized officer /										

Bank / e-Auction service provider will not be held liable for any delay / failure for verification of KYC documents and failure to transfer EMD in wallet. Note : Minimum incremental bid amount for properties with Reserve Price Above than Rs. 1.00 Crore is Rs. 1,00,000/- and with Reserve Price Below than Rs. 1.00 Crore is Rs. 20,000/-

For detailed terms and conditions of sale, please refer to the link provided in https://www.bankofbaroda.in/e-auction.htm and https://ibapi.in. Also, prospective bidders may contact the above mentioned authorized officer.

STATUTORY 15/30 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT TO THE BORROWER / GUARANTOR/ MORTGAGOR

( In The Event Of Any Discrepancy Between The English Version And Any Other Language Version Of This Auction Notice, The English Version Shall Prevail)

Date : 07/05/2021

Place: Baroda

Place: Vapi



Mr. Nandlal Housila Prasad Harizan & Mrs. Rekhadevi Nandlal harizan

Date : 07.05.2021,

Place : Raikot

Min. Nandia Housila Frasad Halizan & Mis. Revitatevi Nandia Harizan Piot No.2, Madhuvan Residency, Near Tulsi Paper Mill, Village- Mota, Taluka -Bardoli, District-Surat, Gujarat-394305. Sub.: Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act," A/c Mr. Nandlal housila Prasad horizon & Mrs. Rekhadevi Nandlal harizan.

Re: Credit facilities with our Pal Branch.

Net or each reaching with our real branch. I. We refer to our letter dated 27-02-2019 conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilising the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under:

Nature and Type of facility	Limit	Rates of Interest	O/s as on 31/03/2021	Security agreement with brief description of securities
Term Loan	Rs.	8.75%	Rs.10,64,925.60	As mentioned below

Description of property : Residencial property situated at Village- Mota, taluka-Bardoli, Dist- Surat, Plot no. 2, Madhuvan Residency, Block no.187, 302, 303, 304, 305, new block no. 187, total area-28.07 sq. mtrs. Boundary: North- society road, South : adj block, East: plot no. 1,West: plot no.3

Dicck, East: pictno. 1, West: pict no. 3
 In the letter of acknowledgement of debt dated 27-02-2019 you have acknowledged your liability to the Bank to the tune of **Rs. 10.00** lakhs as on 27-02-2019 The out standings stated above include further drawings and interest up to 31-03-2021. Other charges debited to the account are **Rs. 10,64,925,60/** As you are aware, you have committed defaults in payment of interest on above loans/outstandings for the quarter ended **March,2021** and onwards.
 Consequent upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 29-05-2020 in accordance with the Reserve Bank of India directives and outgoings.

as non-performing asset on **29-05-2020** in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest threcon. 5. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security InterestAct, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating **Rs. 10,64,925.60**/- as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note. . Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for

Prease note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full.
 We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act

the Act. 8. We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/inviting quotations/itender /private treaty. Please note that after publication of the notice as above, your right for edeem the secured assets will not be available 9. Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us. Yours faithfully,

Place : Surat | Date : 27/04/2021 (Aditi Mishra) Chief manager



Home First Finance Company India Limited, CIN:U65990MH2010PTC240703, Website: homefirstindia.com, Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com **DEMAND NOTICE U/s 13(2)** 

You the below mentioned borrower has availed loan by mortgaging the schedule mentioned property and you the below mention has stood as borrower/co- borrower guarantor for the loan agreement. Consequent to the defaults committed by you, your loan account has been classified as non- performing asset on 06/05/2021 under the provisions of the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (in short SARFAESI Act). We Home First Finance Company India Limited have issued Demand Notice u/s 13(2) read with section 13(13) of the SARFAESI Act to the address furnished by you. The said notices are issued as on 06/05/2021 and these notices state that you have committed default in payment of the various loans sanctioned to you. Therefore, the present publication carried out to serve the notice as the provision of Section 13(2) of SARFAESI Act and in terms of provision to the rule 3(1) of the Security Interest (Enforcement) Rules 2002

Emorcement) Rules, 2002.		
Name and Address of the Account, Borrower(s) & Guarantor(s)	Details of the security to be enforced	Amount due as on 06/05/2021 as per Demand Notice plus further interest and other expenses
Alish Kalabhai Waghela and Ushaben Alishbhai Vaghela	Flat No. 107, Ghanshayam Residency, Nr. Talati Office, Vadsar Village, Vadodara Baroda 390015	Rs. 9,24,836/-
Jagdish Kumar Pravinchandra Shah and Vaishaliben J Shah	Flat No. 102, Building C, EWS TP 60 FP 127 Mukhya mantri Gruh yojana b/h gotri lake ambika nagar gotri Vadodara Gujarat 390007	

You are hereby called upon to pay Home First Finance Company India Limited within the period of 60 days from the date of publication of this Notice the aforesaid amount with interest and cost failing which Home First Finance Company India Limited will take necessary action under the Provisions of the said Act against all or any one or more of the secured assets including taking possession of secured assets of the borrowers, mortgagors and the guarantors. The power available to the Home First Finance Company India Limited under the said act include (1) Power to take possession of the secured assets of the borrowers/guarantors including the rights to transfer by way of lease, assignment of sale for releasing secured assets (2) Take over management of the secured assets including rights to transfer by ways of lease, assignment or sale and realize the secured assets and any transfer as of secured assets by Home First Finance Company India Limited shall vest in all the rights and relation to the secured assets transferred as it the transfer has been made by you. In terms of the Provisions of the Section 13(13) of the said act, you are hereby prohibited from transferring, either by way of sale, lease or otherwise (other than in the normal course of your business), any of the secured assets as referred to above and hypothecated/mortgaged to the Home First Finance Company India Limited without prior consent of the Home First Finance Company India Limited.

AUTHORISED OFFICER, Home First Finance Company India Limited



SBFC Finance Private Limited (erstwhile Small Business Fincredit India Private Limited Registered Office:- Unit No. 103, First Floor, C&B Square, Sangam Complex, SBFC

Authorized Officer,

Bank of Baroda

Village Chakala, Andheri- Kurla Road, Andheri (East), Mumbai-400059. Branch Address: SBFC Finance Private Limited, Block O-7, 1st Floor, Lajpat Nagar - 2, New Delhi - 110024

Date: 06.05.2021

) बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

ower of attorney holders of premises

Branch name Dhanera

### **DEMAND NOTICE**

www.bankofbaroda.com/tenders.asp

Whereas the borrowers/co-borrowers mentioned hereunder had availed the financial assistance from SBFC Finance Private Limited We state that despite having availed the financial assistance, the borrowers/mortgagors have committed various defaults in repayment of interest and principal amounts as per due dates. The account has been classified as Non Performing Asset on the respective date: mentioned hereunder, in the books of SBFC as per guidelines of Reserve Bank of India, consequent to the Authorized Officer of SBFC Finance Private Limited. under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("SARFAESI Act") and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of Security Interest (Enforcement) Rules 2002 issued Demand Notices on respective dates mentioned herein below, calling upon the following borrowers /mortgagors to repay the amount mentioned in the notices together with further interest at the contractual rate on the amount mentioned in the notices and incidental expenses, cost, charges etc. until the date of payment within 60 days from the date of receipt of notices The notices issued to them on their last known addresses have returned un-served and as such they are hereby informed by way of

public notice about the same.							
Name of The Borrower / Address	Date of Demand Notice & Npa	Loan And Outstanding Amount	Property Address of Secured Assets				
1.Kesharsingh Parbatsinh Rajpurohit, 2.Manjudevi Kesharsingh Rajpurohit, Both are residing at Flat No. 402, Venus A B-1, Cosmo City Sayali, Silvassa Dadra and Nagar Haveli- 396230.	Notice Date: 8th April 2021 NPA date: 31st March 2021	Loan Account No. 4021060000005076 (PR00620882) LoanAmount: Rs.1,02,00,000/- LoanAccount No. 574200 (PR00630170) LoanAmount: Rs.15,31,720/- Total Outstanding amount: Rs.1,39,22,680/- (Rupees One Crore Thirty Nine Lakhs Twenty Two Thousand Six Hundred Eighty Only) as on 8th April 2021	All that piece and parcel of the Property bearing Commercial Shop No. 101 bearing Daman Muncipal Council House No. 14-156/A/F-1 admeasuring 1524.18 Sq.Ft. (Built up area), Shop No.102, Bearing Daman Muncipal Council House No. 14-156/A/F-2, admeasuring 663 Sq. Ft. (Built up area), Shop No.103, Daman Muncipal Council House No. 14-156/A/F-3, admeasuring 545.70 Sq. Ft. (Built up area), Shop No. 104, Daman Muncipal Council House No. 14-156/A/F-4, admeasuring 708.90 Sq. Ft. (Built up area) plus corridor, admeasuring 1360Sq. Ft. (Built up area) on First Floor, of the building known as "Fortune Empire" A Wing, constructed on Survey No. 295/1(36-B), (37-4), (37/4-A) & (37/5) situated at Mashal Chowk, Kathiria,Nani Daman, District Daman within the Jurisdiction of Daman Muncipal Council area, Taluka of Daman Sub District and District Daman				

In the circumstances as aforesaid, the notice is hereby given to the above borrowers, co-borrowers, to pay the outstanding dues as mentioned above along with future interest and applicable charges within 60 days from the date of the publication of this notice failing which further steps will be taken after the expiry of 60 days of the date of this notice against the secured assets including taking possession of the secured assets of the borrowers and the mortgagors under Section 13(4) of the SARFAESI Act and the applicable Rules thereunder

Please note that under Section 13 (13) of the SARFAESI Act, no Borrower shall, transfer by way of sale, lease or otherwise any of his secured assets referred to in the notice, without prior written consent of the secured creditor. Sd/-

(Joyai Nauar)
Authorised Officer
SBFC Finance Private Limited

# homefirst

Dated: 7th May 2021

Place: Damar

Home First Finance Company India Limited, CIN:U65990MH2010PTC240703. Website: homefirstindia.com, Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com **DEMAND NOTICE U/s 13(2)** 

You the below mentioned borrower has availed loan by mortgaging the schedule mentioned property and you the below mention has stood as borrower/co- borrower guarantor for the loan agreement. Consequent to the s committed by you, your loan account has been classified as non- performing asset on 06/05 under the provisions of the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 (in short SARFAESI Act). We Home First Finance Company India Limited have issued Demand Notice u/s 13(2) read with section 13(13) of the SARFAESI Act to the address furnished by you. The said notices are issued as on 06/05/2021 and these notices state that you have committed default in payment of the various loans sanctioned to you. Therefore, the present publication carried out to serve the notice as the provision of Section 13(2) of SARFAESI Act and in terms of provision to the rule 3(1) of the Security Interest (Enforcement) Rules, 2002:

Bank of Baroda Pal Branch, 4 to 7 Royal Platinum, Palanpu बैंक ऑफ़ बड़ौदा Canal Road, Surat. Ph.No. -0261-2777734/35, Bank of Baroda email - surpal@bankofbaroda.co.in NOTICE TO BORROWER Date : 26/04/202 UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002 Date : 26/04/202

Mr. Yashvantkumar Rajmani Tiwari & Mrs. Anjali Yashvantkumar Tiwari Plot No. 14, Madhuvan Residency, Near Tulsi Paper Mill, Village- Mota, Taluka - Bardoli, District-Surat, Gujarat-394305.

Sub.: Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter callec "The Act" A/c Mr. Yashvantkumar Rajmani Tiwari & Mrs. Anjali Yashvantkumar Tiwari Dear Sir/s

#### Re: Credit facilities with our Pal Branch.

Net of the difference with our rear branch. I We refer to our letter dated 27-02-2019 conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilising the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under:

Nature and Type of facility	Limit	Rates of Interest	O/s as on 31/03/2021	Security agreement with brief description of securities
Term Loan	Rs. 10,00,000/-	8.75%	Rs.10,78,362.64/-	As mentioned below

Description of property : Residencial property situated at Village- Mota, taluka Bardoli, Dist- Surat, Plot no. 14, Madhuvan Residency, Block no.187, 302, 303, 304, 305 new block no. 187, total area-28.07 sq. mtrs. Boundary : North-plot no.18, South : society road, East : plot no.15, West : plot no. 13

In the letter of acknowledgement of debt dated 27-02-2019 you have acknowledged you liability to the Bank to the tune of Rs. 10.00 lakhs as on 27-02-2019 The out standings stated above include further drawings and interest upto 31-03-2021. Other charges debited to the account are Rs. 10,78,362.64/-

debited to the account are Rs. 10,78,362,64/-8. As you are aware, you have committed defaults in payment of interest on above loans/outstandings for the quarter ended March,2021 and onwards. 4. Consequent upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 30-04-2020 in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon.

. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities dul secured by various securities mentioned in para 1 above, and classification of you secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcementof Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating **Rs**. **10**,**78**,**362**.**64**/- as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note. 5. Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for

5. Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full.
7. We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act. the Act

We further invite your attention to sub section (8) of section 13 of the said Act i 8. We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/inviting quotations/tender /private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available 9. Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the rightto make further demands in respect of sums owing to us. Yours faithfully, Place . Sure 1 Date . 26/04/2021

Place : Surat | Date : 26/04/2021 (Aditi Mishra) Chief manager

You the below mentioned borrower has availed loan by mortgaging the schedule mentioned property and you the below mention has stood as borrower/co- borrower guarantor for the loan agreement. Consequent to the defaults committed by you, your loan account has been classified as non- performing asset on 06/05/2021 under the provisions of the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 (in short SARFAESI Act). We Home First Finance Company India Limited have issued Demand Notice u/s 13(2) read with section 13(13) of the SARFAESI Act to the address furnished by you. The said notices are issued as on 06/05/2021 and these notices state that you have committed default in payment of the various loans sanctioned to you. Therefore, the present publication carried out to serve the notice as the provision of Section 13(2) of SARFAESI Act and in terms of provision to the rule 3(1) of the Security Interest (Enforcement) Rules, 2002:

Name and Address of the Account, Borrower(s) & Guarantor(s)	Details of the security to be enforced	Amount due as on 06/05/2021 as per Demand Notice plus further interest and other expenses.
Sumitraben Barote, Pravin D Barhate & Tejas Barhate	Row House No. 10/A Shreeji Residency Survey no. 229/2, Moje Rata, Near Rata Gram Panchayat Office, Rata Vapi Gujarat 396191	Rs. 15,70,868/-
Audhesh S S Thakur, Jitendra Subhashsing Thakur	Flat No. 402, Building- A, Sai darshan Residency Patel Faliya, Rentlav, Udvada,396185 Valsad Gujarat 396180	Rs. 8,63,761/-
Ramakant Chauhan & Savita Devi	Flat No. 410, Building- D, Devi Krupa Residency, Plot no. 4, SR.No. 533/4, Near shiv shakti Residnecy, Biharinagar, Village Chanod, Taluka Vapi Gujarat 396191	Rs. 10,52, <del>9</del> 08/-
Suvarna Shantaram Jadhav, Naresh Shantaram Jadhav & Minaben Jadav	Flat No. 303, Khushi Apartment Survey no. 11+9/11/2+11 Paiki 27, Charwada Vapi Gujarat 396195	Rs. 9,80,723/-
Asma Khatun Harunahmeo Mansuri, Shahid Mansuri & Haronahmed Mansuri	Flat No. 303, Building- A, Amardeep Apartment, Hira Nagar, Village Chharwada, Taluka Vapi Gujarat 396195	Rs. 7,46,614/-
Manisa Gulabsingh Rathor & Gulab Singh	Flat No. 106, Avadh Residency Ranchhodnagar, Chhiri Vapi Gujarat 396191	Rs. 10,65,701/-
Manisha Sahani & Vinod Kumar Yadav	Flat No. 305. Building- A, Gokul Park, Behind Vrundavan Park, GIDC Sarigam Valsad Gujarat 396155	Rs. 9,89,337/-
Pratibha Daksh Prajapati & Daksh Jiyalal Prajapati	Flat No. 1, Ashirwad Building, Ashriwad, Near Morarji Circle, GIDC, Vapi Gujarat 396195	Rs. 15,98,615/-
Dilipkumar N Prajapati and Arati Prajapati	Flat No. 201, B wing, Sai Garden, Survey No 337, sub plot no 28,29,30,31 Moje; - Karwad Tal- Vapi Dis - Valsad Vapi Gujarat 396191	Rs. 8,85,227/-

You are hereby called upon to pay Home First Finance Company India Limited within the period of 60 days from the date of publication of this Notice the aforesaid amount with interest and cost failing which Home First Finance Company India Limited will take necessary action under the Provisions of the said Act against all or any one or more of the secured assets including taking possession of secured assets of the borrowers, mortgagors and the guarantors. The power available to the **Home First Finance Company India Limited** under the said act include (1) Power to take possession of the secured assets of the borrowers/guarantors including the rights to transfer by way of lease, assignment of sale for releasing secured assets (2) Take over management of the secured assets including rights to transfer by ways of lease, assignment or sale and realize the secured assets and any transfer as of secured assets by Home First Finance Company India Limited shall vest in all the rights and relation to the secured assets transferred as it the transfer has been made by you. In terms of the Provisions of the Section 13(13) of the said act, you are hereby prohibited from transferring, either by way of sale, lease of otherwise (other than in the normal course of your business), any of the secured assets as referred to above and hypothecated/mortgaged to the Home First Finance Company India Limited without prior consent of the Home First Finance Company India Limited. Date : 07/05/2021

#### AUTHORISED OFFICER, Home First Finance Company India Limited

Date : 07/05/2021

Place: Gandhidham

Name and Address of the Account, Borrower(s) & Guarantor(s)	of the Details of the security bunt, Borrower(s)			
Dharmendra Giri & Ginni Devi	& Varsamedi RS No 539/4 Opposite Shantidham Society			
Ankit Tiwari, Chanchal Tiwari & Sachin Tiwari	Chanchal Tiwari Varsamedi RS No 539/4 Opposite Shantidham Society			
Sugnaben Adhiwal & Vinay Adiwal	ugnaben Adhiwal Row House No. 26 A Gayatri Home Residency, Survey No.			
Ashok Shahaji Shinde & Latabai Shahaji Shinde	Flat No. 42/B, GF, Gayatri Home Residency Survey No 254/1/Paikii 1 Gandhidham Gujarat 370110	Rs. 6,96,316/-		
Jaypalsinh Vikramsinh Zala, Arjunsinh Zala Ashaben Jaypalsinh Rana	Row House No. 3, Ayodhya Nagar, Block- 90-91, Survey No 741, Beside Grukrupa Nagar, Nr. Welspun Gram, Approaching Anjar To Bhachua Bypass Road, Varamedi Taluka Anjar Kachchh Gujarat 370110	Rs. 10,55,073/-		
Kamlesh Harchand Jangid, Devika Kamlesh Jangid Madan Harchandbhai Jangid	Row House on Plot No 271 & 272, Meghpar Borichi R. S. No 171, Tulsidham / Near Golden Park/ Near Vithal Nagar, Approaching Galpadar Road (NH 8A Extension), At M. Borichi, Taluka Anjar, Dist. Kutch Megpar Borichi Gujarat 370110	Rs. 35,48,139/-		
Omprakash Barupal, Laxman Barupal	Row House 95 Bageshree Township 3, Behind Bageshree township 6, Varsamedi Gandhidham Gujarat 370210	Rs. 38,49,001/-		
Sachin Kapoor & Sakshi Kapoor	Flat No. 10, Bhagyashree Arcade, Rs No 479/1 and 479/2 Vill Varsamedi Anjar Near Guru Gobind Singh Nagar Anjar Gujarat 370201	Rs. 8,52,414/-		
You are hereby called upon to pay <b>Home First Finance Company India Limited</b> within the perior from the date of publication of this Notice the aforesaid amount with interest and cost failing which <b>Finance Company India Limited</b> will take necessary action under the Provisions of the said Act any one or more of the secured assets including taking possession of secured assets of the mortgagors and the guarantors. The power available to the <b>Home First Finance Company India</b> Li				

the said act include (1) Power to take possession of the secured assets of the borrowers/guarantors including the rights to transfer by way of lease, assignment of sale for releasing secured assets (2) Take over management of the secured assets including rights to transfer by ways of lease, assignment or sale and realize the secured assets and any transfer as of secured assets by Home First Finance Company India Limited shall vest in all the rights and relation to the secured assets transferred as it the transfer has been made by you. In terms of the Provisions of the Section 13(13) of the said act, you are hereby prohibited from transferring, either by way of sale, ease or otherwise (other than in the normal course of your business), any of the secured assets as referred to above and hypothecated/mortgaged to the Home First Finance Company India Limited without prior consent of the Home First Finance Company India Limited.

#### AUTHORISED OFFICER, Home First Finance Company India Limited

મળી શકશે.

<u>્રિ Shrenik</u> શ્રેણિક લીમીટેડ

**ોંઘણી કાર્યાલયઃ** ૫૦૫/૫૦૮. ટેન-ઇલેવન, મરડીયા પ્લાઝાની સામે, સીજી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, ગુજરા કોન : (૦૭૯) ૨૬૪૪૦૩૦૩ ટેલીકેક્સ : (૦૭૯) ૨૬૪૦૬૮૧૦ <mark>ઇમેઇલ</mark>ઃ <u>cs@shrenik.co.in</u> વેબસાઇટઃ <u>www.shrenik.co.in</u> નોટીસ સિક્યોરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા (લીસ્ટીંગ ઓબ્લીગેસન્સ અને ડીસ્ક્લોઝર આવશ્યક્તાઓ અધિનિયમ, ૨૦૧૫ ના નિયમ ૨૯ ની સાથે નિયમ ૪૭ ને ઘ્યાને લેતાં આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના ૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના રોજ પુરા થતા માસિક અને વાર્ષિક ઓડીટેડ નાણાંકીય પરીણામો અને નિવેદનો અને અન્ય કામકાજી બાબતોની ચર્ચા કરી મંજૂરી આપવા અંગે કંપનીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની મીટીંગ તા. ૧૩મી મે ૨૦૨૧ ને ગુરુવારના રોજ આયોજીત કરવામાં આવેલ છે. ઉપર્યક્ત નોટીસ કંપનીની વેબસાઇટ www.shrenik.co.in ખાતે તથા નેશનલ સ્ટોક એક્ષચેન્જની વેબસાઇટ www.nseindia.com ખાતે જોવા

CIN:151396GJ2012PLC073061

સહી/-શ્રેણિક લીમીટેડ વતી,

ા ૭. રીઝોલ્યુશન પ્રોફેશનલને રીઝોલ્યુશન પ્લાનો

એ ડજ્ ડીકેટીંગ ઓથોરીટીને મંજૂરી માટે રીઝોલ્યુક

પ્લાનની સુપરતગીની અંદાજિત તારીખ

ઝોલ્યુશન પ્રોફેશનલનું નામ, સરનામું અન મેઇલ, બોર્ડના ૨જીસ્ટર્ડ મુજબ

રેઝોલ્યુશન પ્રોફેશનલ સાથે પત્રવ્યવહાર મા

વાપરવાનું સરનામું અને ઇમેઇલ

૨. વધુ વિગતો મેળવી શકાશે :

નારીખ : ૦૭.૦૫.૨૦૨૧

સ્થળ : અમદાવાદ

૩. ફોર્મ જી ના પ્રકાશનની તારીખ

ઝોલ્યુશન પ્રોફેશનલનું નામ તને રજીસ્ટ્રેશન નંબર

પરત કરવાની રીત

## કાયનાન્સિયલ એક્સપ્રેસ

	એક્સપ્રેશન ઓફ (ઇન્સોલ્વેન્સી અને બેન્ક્રપ્ટ	<b>દ્દોર્મ જી</b> ઇ <b>ન્ટરેસ્ટ માટે આમંત્રાણ</b> સી (કોર્પોરેટ પર્સન્સ માટે ઇન્સોલ્વેન્સી ો, ૨૦૧૬) ના નિયમન ૩૬ એ (૧) હેઠળ	년 고	્રિ <b>્ઝની ને</b> મ્ય ઓફીસ : જના હેલો માળ, સર્વે નં નર દિંગ રોડ, ઇજી
	સબં	દ્યિત વિગતો		સોનાના દા
۹.	કોર્પોરેટ દેવાઘરનું નામ	હિત થર્મ પ્રાઇવેટ લીમીટેડ	નીરે	જાગાવેલ દેવાદારો ઘણ
२.	કોર્પોરેટ દેવાદારના સંસ્થાપનની તારીખ	૨૫.૦૭.૨૦૧૪	2150	વવામાં અને સોનાના
з.	ઓથોરીટી જેના હેઠળ કોર્પોરેટ	કંપનીના રજીસ્ટ્રાર - અમદાવાદ		ાવેલ લોન એક્તઉન્ટોમાં
	ડેબ્ટર ઇનકોર્પોરેટડ/રજીસ્ટર્ડ છે.	In Product Association (1993) In Production		
۲.	કોર્પોરેટ દેવાદારનો કોર્પોરેટ ઓળખ નંબર /	U29220GJ2014PTC080245		જીથી અમારી શાખા ઉ
	લીમીટેડ લાયબીલીટી આઇડેન્ટીફીકેશન નંબર			ાામાં આવશે. ભાગ લેવ
પ.	કોર્પોરેટ દેવાદારની રજીસ્ટર્ડ ઓફીસ અને	પ્લોટ નં. ૮૭૬, રોડ નં. ૮૪/૪, જીઆઇડીસી,		ાવ્યા વગર કોઇપણ બી
	મુખ્ય ઓફીસ (જો હોય તો) નું સરનામું	સચિન, સુરત-૩૯૪૫૨૦	લવી	કે જો હરાજી તે દિવસે
<b>5</b> .	કોર્પોરેટ દેવાદારની ઇન્સોલ્વેન્સી શરૂ થવાની તારીખ	<b>૧૮/૧૨/૨</b> 0૨0	265	ો. જો ગ્રાહકનું અવર
		(આદેશ ૨૪/૧૨/૨૦૨૦ના રોજ અપલોડ કરાયો હતો)		સદારને તે લાગુ પડશે.
э.	એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટના આમંત્રણની તારીખ	03/04/2029		આકસ્મિક ખર્ચ સહીલ
٤.	કો ડની કલમ ૨૫(૨)(એચ) હેઠળ રીઝોલ્યુશન	વિગતો cnjabd@gmail.com પર ઇમેઇલ		ોનાનું વેચાણ કરવામાં
	અરજદારોની લાયકાત ઉપલબ્ધ રહેશે:	મોકલીને મેળવી શકાશે.		
e.	કલમ ૨૯એ હેઠળ લાગુ લાયકાતના	આઇબીબીઆઇની વેબસાઇટ (www.ibbi.gov.in/legal-	વસુલવામાં આવશે. કોઠ	
	નિયમો ઉપલબ્ધ રહેશેઃ	framework/act) પર ઉપલબ્ધ રહેશે અથવા	<b></b>	ાાના સરનામાની વિગલ
		cnjabd@gmail.com પર ઇમેઇલ મોકલીને મેળવી શકાશે.	-	લોન એકાઉન્ટ
۹0.		૨૩/૦૫/૨૦૨૧	ક્રમ	
	છેલી તારીખ		નં.	નંબર
۹٩.	3	26/04/2029	1	30768730000191
۹.२.	યાદી જારી કરવાની તારીખ કામચલાઉ યાદીના વાંધાઓ સુપરત કરવાની	02/05/2029		20100120000131
૧૨.	કામચલાહયાદાના વાધાઓ સુપરત કરવાના છેલ્લી તારીખ	02/05/2024	90	ા સ્મોલ ફાચનાન્સ વ
٩3.		08/05/2021	- 1	•
૧૩.	ભાવા રાઝાલ્યુશન અરજદારાના આતમ વાદા જારા કરવાની તારીખ	08/05/2024		જૂના નારોલ
૧૪.		02/05/2021	2	30768740000030
	માહાતા મમારપડમ, મુલ્પાકમ મદ્રાક્સ અપ ભાષા રીઝોલ્યુશન અરજદારોને રીઝોલ્યુશન પ્લાનની	or other	3	30768740000040
	વિનંતી જારી કરવાની તારીખ		-	
૧૫.		રીઝોલ્યુશન પ્રોફેશનલ આઇબીસીની કલમ ૨૯(૨)મુજબ	- 1	જના સ્મોલ ફ
	માહીતી મેમોરેન્ડમ અને અન્ય માહિતી	કોન્કીડેન્સીયલ અંડરટેકિંગ કર્યા પછી કમીટી ઓફ ક્રેડીટર્સ દ્વારા		- વલભવાડી રામબ
	માટે વિનંતી મેળવવાની રીત	જણાવાયેલ લાયકાતના માપદંડો સંતોષતા લાયક અને ચૂંટાયેલ		પલાળપાડા રામળ
		રીઝોલ્યુશન અરજદારોને ફક્ત ઇમેઇલથી શેર કરશે.	4	30968740000020
٩૬.	રીઝોલ્યુશન પ્લાન જમા કરવાની છેલીતારીખ	08/09/2021	5	30968740000190

રીઝોલ્યુશન પ્લાન ક્રમ નં.૨૧ માં જણાવેલ સરનામા પર સીલબંધ રાઝાલ્યુલન ચાન કેમ મારે કે માં કે જોયલે સરમાળો પર સાલગય કવરમાં જમા કરવાના રહેશે. રીઝોલ્યુશન પ્લાન નીચેના ઇ-મેઇલ આઇડી પર ઇલેક્ટ્રોનિક રીતે પણ

રજી. નં.: IBBI/IPA-001/IP-P00154/2017-2018/10323

શ્રી નિમાઇ ગૌત્તમ શાહ ૬૦૫-૬૦૬-૬૦૭, સિલ્વર હોક્સ, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે,

૬૦૫-૬૦૬-૬૦૭, સિલ્વર હોક્સ, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે

શ્રી નિમાઇ ગૌત્તમ શાહ, ઇમેઇલ : cnjabd@gmail.com

સહા/- ગ્રા નિમાઇ ગાલમ શાહ હિત થર્મ પ્રાઇવેટ લીમીટેડના રિઝોલ્યુશન પ્રોફેશનલ ૨જી. નં. : IBBI/IPA-001/IP-P00154/2017-2018/10323

પાલડી, અમદાવાદ–૩૮૦ ૦૦૭. **ઇમેઇલ** : cnjabd@gmail.con

૦૫–૬૦૬–૬૦૭, સિલ્વર ઓક્સ મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે

સહી/– શ્રી નિમાઇ ગૌત્તમ શા

જમા કરી શકાશે : cnjabd@gmail.com

08/02/2029

શ્રી નિમાઇ ગૌત્તમ શાહ

પાલડી. અમદાવાદ-૩૮૦ ૦૦૭ ઇમેઇલ : cnjabd@gmail.com

**પાલ** (), અમદાવાદ-370,009

09/04/2029

મેઇલ : cnjabd@gmail.com

ác II				13	33998730002940		10.00
100.10		મોલ ફાચનાન્સ (શિડ્યુલ્ડ કોમસિંચલ બેંક)	12	14	33998740000150	હિતેશ સત્વાણી / લાલચંદ	22.14
-	ດ ລະມີເລີລະ	<sup>(શાડ્</sup> યુલ્ડ કામાસચલ બક) સ્મોલ ફાચનાન્સ બેંક લીમીટેડ – ધ ફેરવે, ગ્રા	6	15	33998740000173	નાનાલાલ ભાલોડીચા / નાથાભાઈ	21.81
				16	33998740000482	પ્રકાશ એમ.ઠક્કર / મુકેશભાઈ	42.80
		૧૦/૧, ૧૧/૨ અને ૧૨/૨બી, ઓફ દોમલુ૨, ક		17	33998740000532	સુમનદેવી તોમર / રામઅવતાર	12.10
fla	ઇનર રિંગ રોડ, ઇજીએલ બિઝનેસ પાર્ક પછી, ચલાઘટ્ટા, બેંગલોર–પદ્૦૦૭૧			18	33998740000594	મહેશકુમાર રાઠોડ / પ્રેમજીભાઈ	10.50
	સોનાના દા	ગીનાની હરાજી માટે જાહેર નોઢ	ટીસ	19	33998740000670	ચૌહાણ લક્ષ્મણજી / લક્ષ્મણજી	9.80
નીચે '	જ્ણાવેલ દેવાદારો ઘણી	ા વખત ચાદ કરાવ્યા છતાં જણાવેલ સમય ગાળા દરમિય	ાન લોન પરત	20	33998740000759	શારદાબેન ગાડીચાલુહાર / ભીખાભાઈ	12.45
		દાગીના છોડાવામાં નિષ્ફળ ગયા છે. નીચે જણાવેલ કે		21	33998740000798	સુમનદેવી તોમર / રામઅવતાર	8.60
จายแล้	વેલ લોન એકાઉન્ટોમાં :	ગીરો મુકાચેલ સોનાના દાગીના/ઘરેણાનું જાહેર/ઓનલા	ાઇન/ખાનગી	22	33998740000861	કેલ્વીન ખ્રીસ્તી / અનિલભાઈ	19.96
		માઇસીસોમાં ૧૭–૦૫–૨૦૨૧ ના રોજ સવારે ૧૦.૩૦		90		નેંક લીમીટેડ , ગ્રાઉન્ડ ફ્લોર, સર્વે નં. ૪૨૧ , વેદ બં	
		માંગતા હોય તેમને શાખાનો સંપર્ક કરવા વિનંતી છે. બેંક ક		⊢		નાના ચિલોડા અમદાવાદ, નારોલ-૩૮૨૩૬૧, ભાર	-
		નો સ્વીકાર અથવા અસ્વીકાર કરવાનો અનામત હક ધ માર્પ પરી ભાગ છે. પેરાવર પે સ્પુર્વે પ્રાપ્ય કે આવ્યું આવે આવ્યું છે.		23	33548730005699	રાઠોડ મંજુલાબેન / સોમાભાઈ	8.35
		રૂર્ણ નહી થાચ તો, તેજશ્વરતો અને નિચમો સાથે આગામ ાન થાચ તો હરાજીની તમામ શરતોને આધારે વારર		24		પરમાર ભક્તિબેન / નટવરભાઈ	25.30
		માથી દેવાદારોને હરાજીની તારીખ પહેલા અંતિમ તારીખ		পল		ક લીમીટેડ, પહેલો માળ, શોપ નં. ૧, એ ટાવર, સિ	ાગ્નેટ પ્લા
		ચુકવણી કરવા જણાવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતા ર		⊢		ચાર રસ્તા ગોત્રી, વડોદરા–૩૯૦૦૨૧, ભારત	
		આવશે અને બાકી ૨કમ, જો કોઇ હોચ તો વ્યાજ અને		25	31808740000098	સોની ભારતીબેન કાળીદાસ / બચુભાઈ	32.75
વસુલ	ાવામાં આવશે. કોઇપણ	પુછપરછ અને શરતો અને નિચમો માટે અમારી શાખાનો		26		મીર સામંતભાઇ / સામંતભાઇ	30.90
શાખા	ાના સરનામાની વિગતે	ો માટે www.janabank.com ની મુલાકાત લેવી.		1		ા બેંક લીમીટેડ , દત્ત આર્કેડ , પહેલો માળ , શોપ નં.	
ક્રમ	લોન એકાઉન્ટ		ગીરો સોનાના			વાડ પાર્ટી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીચા પાસે રીજનલ ર દ રોડ, તાલુકો નડીચાદ, નડીચાદ–૩૮૭૦૦૨, ભા	
નં.	નંબર	દેવાદાર/સહ–દેવાદારનું નામ	દાગીનાનું	07	31498740000091	જગદીશભાઈ જાસમતભાઇ ડાભી / જાસમતભાઇ	8.90
			કુલ વજન	27	31498740000217		
1	30768730000191	પરમાર નચનાબેન / સાદાભાઈ	46.98	28	· · · · · ·	અરૂણભાઈ પરમાર / ભાવુભાઈ	46.99
જના	સ્મોલ ફાચનાન્સ બેં	ંક લીમીટેડ, પહેલો માળ, નં. ૨૧, ૨૨, ૨૩, રૂદ્રા ગ્રીવ	ન કોમ્પલેક્ષ,	I 1	જના સ્મોલ ફાચનાન	સ બેંક લીમીટેડ, ૨૦૧/૨૦૨, શ્રી અષ્ટ્વિનાચક સી	ોટી મોલ,
	જૂના નારોલ	કોર્ટ પાસે, નારોલ, અમદાવાદ-૩૮૨૪૦૫, ભારત.			માદ્યવ દર્શવ	ન, વાઘાવાડી રોડ, ભાવનગર–૩૬૪૦૦૧, ભારત	
2	30768740000030	કુસુમબેન સોલંકી / ભોગીલાલ	57.71	29	45198740000028	ગોસ્વામી અંબાદતગીરી / અંબાદતગીરી	13.60
	30768740000040	કુસુમબેન સોલંકી / ભોગીલાલ	35.74	F	જના સ્મોલ કાચન	ાન્સ બેંક લીમીટેડ , સાપ્પીરી એલીગન્સ , ગ્રાઉન્ડ ક	કલોર.
	જના ગ્રામેલ હા	ચનાન્સ બેંક લીમીટેડ, ચોથો માળ, શાંત પ્રભા હાઈ		1		તો માળ નં. ૧૧૪ સર્વે નં. ૧૦૧૩, સંત કંવર રામ ચો	
					વાઘ	ાવાડી રોડ, ભાવનગર−૩૬૪૦૦૨, ભારત	
	1	ગ સામે, જવાહર ચોક, મણીનગર, અમદાવાદ–૩૮૦		30	45228740000234	ઈલાબેન અસાર / ચુનીલાલ	481.94
4	30968740000020	સુનિતાબેન પટણી / જ્યંતિભાઈ	19.80	90	ના સ્મોલ કાચનાન્સ બ	ોંક લીમીટેડ. પહેલો માળ. બિઝનેસ એવન્થ. પ્લોટ	ટ નં. દ૨/૨
-	30968740000190	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ	35.06	970		મેંક લીમીટેડ , પહેલો માળ , બિઝનેસ એવન્થુ , પ્લોર પાસે કાલાલાદ રોડ રાજકોર- રડ૦૦૦૫ ભારત	
-	30968740000190		35.06	L	કેકેવી સર્કલ	પાસે, કાલાવાડ રોડ, રાજ્કોટ–૩૬૦૦૦૫, ભારત	
-	30968740000190 જના સ્મોલ ફાચના	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ	35.06 મોલ,	31	કેકેવી સર્કલ 33538740000110	પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા	12.61
5	30968740000190 જના સ્મોલ ફાચના ઠક્કરનગર ઓવર	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ ન્સ બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨	35.06 મોલ, ૩૫૦.	L	કેકેવી સર્કલ	પાસે, કાલાવાડ રોડ, રાજ્કોટ–૩૬૦૦૦૫, ભારત	12.61
5	30968740000190 જના સ્મોલ ફાચના ઠક્કરનગર ઓવર 30978740000035	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ ન્સ બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨ ધર્નબ્લ સોની / સુરેશકુમાર	35.06 મોલ, ૩૫૦. 23.53	31 32	કેકેવી સર્કલ 33538740000110 33538740000136	પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા	12.61
5 6 7	30968740000190 જના સ્મોલ ફાચના ઠક્કરનગર શોવર 30978740000035 30978740000051	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ ાન્સ બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨ ધર્નબ્લ સોની / સુરેશકુમાર સીતાબેન ઠાકોર / હિરાજી	35.06 મોલ, ૩૫૦.	31 32	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ા સ્મોલ ફાથનાન્સ બેં	ાપાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શૈખ / જુમન મીરજા પુજા ચોધરી / રાઢુલભાઇ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ	12.61 12.95 ਵਿਰਭ ਪਗ
5 6 7	30968740000190 જના સ્મોલ ફાચના ઠક્કરનગર ઓવર 30978740000035 30978740000051 3097874000087	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ ાન્સ બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨ ધનંજ્ય સોની / સુરેશકુમાર સીતાબેન ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઈ / દશરથભાઈ	35.06 મોલ, 3પo. 23.53 15.32 58.67	31 32 90	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ા સ્મોલ ફાથનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ૨	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા પુજા ચોધરી / રાહુલભાઇ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ ોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા	12.61 12.95 ਵਿਰਡ ਪਗ: ਵਰ
5 6 7	30968740000190 જના સ્મોલ ફાશના ઠક્કરનગર ઓવર 30978740000035 30978740000051 30978740000087 જના સ્મોલ ફાશ્વ શીપ નં. એફ	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ ન્સ બેંક લીમીટેક, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોક, નિકોલ, અમદાવાદ–૩૮૨ દાનંજ્ય રોની / સુરેશસુમાર સીતાબેન ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઇ / દશરથભાઇ નાન્સ બેંક લીમીટેક, પહેલો માળ, શિવાલીક કોમ્પલે ન- વ અને ગેફ 2, નારઘપૂરા, અમીવુંજ કોસ રોક,	35.06 મોલ, 3પo. 23.53 15.32 58.67	31 32 <b>°r</b> o 33	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ા સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ૨ 45248740000034	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા પુજા ચૌધરી / રાહુલભાઇ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ દોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઇ	12.61 12.95 ਵਿਰਭ ਪਗਸ਼ ਵਿਰ 27.04
5 6 7	30968740000190 જના સ્મોલ ફાશના ઠક્કટનગર ઓવર 30978740000035 30978740000051 30978740000087 જના સ્મોલ ફાશન શીપ નં. એક્ નારણપુરા પ	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ બ્સ બેંક લીમીટેક, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોક, નિકોલ, અમદાવાદ–૩૮૨ દાનંજ્ય સોની / સુરેશકુમાર સીતાબેન ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઈ / દશરથભાઈ નાન્સ બેંક લીમીટેક, પહેલો માળ, શિવાલીક કોમ્પલે ન- ૧ અને એફ ર, નારદાપુરા, અમીકુંજ કોસ સેક, ોસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–૩૮૦૦૧૩. ભારત	35.06 મોલ, 3પo. 23.53 15.32 58.67 વેક્ષ,	31 32 90	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ા સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ૨ 4524874000034 4524874000086	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા પુજા ચૌધરી / રાહુલભાઈ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ દોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઈ ધાકેશા દાનશ્યામભાઈ / દાનશ્યામભાઈ	12.61 12.95 स्तिङ प्लाः स्टित 27.04 70.88
5 6 7 8 9	30968740000190 જના સ્મોલ ફાશના ઠક્કરનગર ઓવર 3097874000035 30978740000087 જના સ્મોલ ફાશ્વ શોય નં. એફ નારણપુરા પ્ 33028730003138	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ બ્સ બેંક લીમીટેક, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, બિકોલ રોક, બિકોલ, અમદાવાદ–૩૮૨ દાનંજ્ય સોની / સુરેશસુમાર સીતાબેન ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઇ / દશરથભાઇ ગાન્સ બેંક લીમીટેક, પહેલો માળ, શિવાલીક કોમ્પલે +- ૧ અને ગેફ ન્- , નારદાપુરા, અમીફંજ કોસ રોક, ોસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–૩૮૦૦૧૩. ભારત સપના / પુતાનસિંહ	35.06 भोल, 340. 23.53 15.32 58.67 देक्ष, 4.47	31 32 <b>°r</b> o 33	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ા સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ટ 45248740000034 45248740000086 જના સ્મોલ ફ	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શૈખ / જુમન મીરજા પુજા ચૌધરી / રાદુલભાઇ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ ોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઇ ધાકેશા ઘનશ્શામભાઇ / ઘનશ્યામભાઇ ાથનાન્સ બેંક લીમીટેડ, ગ્રાઉન્ડ અને પહેલો માળ	12.61 12.95 स्टितङ प्रवा: स्टत 27.04 70.88
5 6 7 8 9	30968740000190 จาตเ ะิพโต ธุเยอา 6552 ตาวเ ะ อพิเตะ 30978740000035 30978740000051 30978740000087 จาตเ ะิพโต ธุเยล ค่าะเขเนูยเ น 33028730003138 33028730003980	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ ન્સ બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, બિકોલ રોડ, બિકોલ, અમદાવાદ–૩૮૨ દાનંજ્ય સોની / સુરેશસુમાર સીતાબેન ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઇ / દશરથભાઇ ગાન્સ બેંક લીમીટેડ, પહેલો માળ, શિવાલીક કોમ્પલે ;-વ અને ગેફ-ર, નારદાપુરા, અમીફંજ કોસ રોડ, ોસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–૩૮૦૦૧૩. ભારત સાપના / પુતાનસિંહ સંદિપકુમાર તિવારી / શીવકુમાર	35.06 भोदा, 3ਪo. 23.53 15.32 58.67 देक्ष, 4.47 8.81	31 32 <b>°r</b> o 33	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ાા સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ર 45248740000034 45248740000086 જના સ્મોલ ફ ક્રલોક બિઝનેસ સે	પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શૈખ / જુમન મીરજ પુજા ચોધરી / રાઢુલભાઇ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ ોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાઢ્યાભાઇ ધાકેશા દાનશ્શામભાઇ / દાનશ્થામભાઇ ાચનાન્સ બેંક લીમીટેડ, ગ્રાઉન્ડ અને પહેલો માળ ન્ટર તરીકે જાશીતી, શોપ નં. ૧ અને ૨, પ્લોટ નં.	12.61 12.95 स्तिक प्लाः स्टत 27.04 70.88 , 366,
5 6 7 8 9	30968740000190 જના સ્મોલ ફાશના ઠક્કરનગર ઓવર 30978740000035 30978740000051 30978740000087 જના સ્મોલ ફાશનુ ગારણપુરા 33028730003188 33028730003188 રસ્મોલ ફાશનાન્સ બે	ગોપાલ પરીઠર / પ્રેમપાલસિંહ 	35.06 भोदा, 3ਪo. 23.53 15.32 58.67 देख, 4.47 8.81	31 32 <b>°r</b> o 33	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ાા સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ર 45248740000034 45248740000086 જના સ્મોલ ક્ ક્લોક બિઝનેસ સે સુરત સીટી,	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શૈખ / જુમન મીરજા પુજા ચૌધરી / રાદુલભાઇ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ ોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઇ ધાકેશા ઘનશ્શામભાઇ / ઘનશ્યામભાઇ ાથનાન્સ બેંક લીમીટેડ, ગ્રાઉન્ડ અને પહેલો માળ	12.61 12.95 दितङ प्ला: रित 27.04 70.88 , 366,
6 7 8 9 10 <b>voi</b>	30968740000190 જના સ્મોલ ફાશના ઠક્કરન ગર શોવર 30978740000035 30978740000051 30978740000087 જના સ્મોલ ફાશ્વ શોપ નં. શેફ નારણપુરા 33028730003138 33028730003188 33028730003980 સ્મોલ ફાશનાન્સ બેં જૂના નારોલ	ગોપાલ પરીઠર / પ્રેમપાલસિંઠ ાન્સ બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨ દાર્વા સોની / સુરેશકુમાર સીતાબેન ઠાકોર / હિરાજી ઠાકેર દશરથભાઈ / દશરથભાઈ નાન્સ બેંક લીમીટેડ, પહેલો માળ, શિવાલીક કોમ્પલે ;−૧ અને શેફ-૨, નારણપુરા, અમીકુંજ કોસ રોડ, પ્રોસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–૩૮૦૦૧૩. ભારત સાપના / પુતાનસિંઠ સંદિપદુમાર તિવારી / શીવકુમાર કં લીમીટેડ, પહેલો માળ, નં. ૨૧, ૨૨, ૨૩, રૂડ્રા ગીલ કોર્ટ પાસે, નારોલ, અમદાવાદ–૩૮૨૪૦૫, ભારત.	35.06 भोख, 340. 23.53 15.32 58.67 देक्ष, 4.47 8.81 ज डोम्पलेक्ष,	31 32 33 33 34 35	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ાા સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ૨ 4524874000034 4524874000034 4524874000036 જના સ્મોલ ફ જ્લોક બિઝનેસ સે સુરત સીટી, 30538730005906	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજ પુજા શોધરી / રાહુલભાઈ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ ોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ છુગ્ગેશ / ડાહ્યાભાઈ ધાકેશા ઘનશ્શામભાઈ / ઘનશ્શામભાઈ ધાકેશા ઘનશ્શામભાઈ / ઘનશ્શામભાઈ ચાનગર બેંક લીમીટેડ, ગ્રાઉન્ડ અને પહેલો માળ ન્ટર તરીકે જાણીતી, શોપ નં. ૧ અને ૨, પ્લોટ નં. રીંગ રોડ, ઉદ્યના દરવાજા સુરત–૩૯૫૦૦૨, ભારત ગંગાબેન મારવાડી / કિશનભાઈ મારવાડી	12.61 12.95 दितंड प्लाः ट्रितंड 27.04 70.68 , 366, 1 8.05
6 7 8 9 10 <b>vol</b> 11	30968740000190 જના સ્મોલ ફાશના ઠક્કરનગર ઓવર 3097874000035 30978740000051 3097874000087 જના સ્મોલ ફાશ શોપ નં. એફ નારણપુરા 33028730003188 33028730003188 સ્મોલ ફાશનાન્સ બે ડૂગા નારોલ 33208740000262	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ ગ્ન બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨ દાર્ગલ્ય સોની / સુરેશકુમાર સીતાબેન ઠાકોર / હિરાઝુ ઠાકેર દશરથભાઈ / દશરથભાઈ ગાન્સ બેંક લીમીટેડ, પહેલો માળ, શિવાલીક કોમ્પલે ;–૧ અને એફ–૨, નારણપુરા, અમીકુંજ ક્રોસ રોડ, પ્રોસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–૩૮૦૦૧૩. ભારત સાપના / પુતાનસિંહ સંદિપદુમાર તિવારી / શીવકુમાર ક લીમીટેડ, પહેલો માળ, નં. ૧૧, ૨૨, ૨૩, રૂવ્ર, ગી કોર્ટ પાસે, નારોલ, અમદાવાદ–૩૮૨૪૫, ભારત. શાહ હરેશકુમાર / અમૃતલાલ	35.06 भोस, 3ਪo. 23.53 15.32 58.67 देक्ष, 4.47 8.81 ज डोम्पलेक्ष, 30.10	31 32 <b>%</b> 33 34	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 iii સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ર 45248740000034 45248740000086 જના સ્મોલ ફ બ્રલોક બિપ્રગ્નેસ સ સુરત સીટ1, 30538730005906 30538730006731	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા પુજા ચૌધરી / રાદુલભાઈ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ પોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઈ ધાકેશા દાનશ્શામભાઈ / દાનશ્શામભાઈ પંચનાવ્સ બેંક લીમીટેડ, ગ્રાઉન્ડ અને પહેલો માળ ન્ટર તરીકે જાણીતી, શોપ નં. ૧ અને ૨, પ્લોટ નં. રીંગ રોડ, ઉદ્યના દરવાજા સુરત–૩૯૫૦૦૨, ભારટ ગંગાબેન મારવાડી / કિશનભાઈ મારવાડી મહેન્દ્ર વસવા / ઉમેશભાઈ	12.61 12.95 Reas val: 27.04 27.04 70.68 360 360 360 360 360 360 360 360 360 360
5 6 7 8 9 10 <b>9</b> 10 <b>9</b>	30968740000190	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ ગ્લ બેંક લીમીટેક, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોક, નિકોલ, અમદાવાદ–૩૮૨ દાગંભ્ય રોગી / સુરેશકુમાર સીતાબેન ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઈ / દશરથભાઈ નાન્સ બેંક લીમીટેક, પહેલો માળ, શિવાલીક કોમ્પલે ;- ૧ અને શેફ – ૨, નારણપુરા, અમીકુંજ ક્રોસ રોક, ોસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–૩૮૦૦૧૩. ભારત સપના / પુતાનસિંહ સંદિયકુમાર તિવારી / શીવકુમાર કંક લીમીટેક, પહેલો માળ, નં. ૨૧, ૨૨, ૨૩, રૂઘ્ન ગ્રીન્ કોર્ટ પાસે, નારોલ, અમદાવાદ–૩૮૨૪૫, ભારત. શાહ હરેશકુમાર / અમૃતલાલ	35.06 Ha, 340. 23.53 15.32 58.67 4.47 8.81 of Shudag, 30.10 20.10 20.10	31 32 33 33 34 35 35 36	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ાા સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ટ 45248740000034 4524874000086 જના સ્મોલ ફ ઝલોક બિઝનેસ સે ઝુરત સીટી, 30538730005906 30538730006807	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા પુજા ચૌધરી / રાહુલભાઈ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ ોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઈ ધાકેવા દનશ્યામભાઈ / દાહ્યાભાઈ ધાકેવા લગ્લ્યામભાઈ / ડાહ્યાભાઈ ચાનવ્સ બેંક લીમીટેડ, માઉન્જ અને પહેલો માળ નગ્રર તરીકે જાણીતી, શોપ નં. ૧ અને ૨, પ્લોટ નં. રીંગ રોડ, ઉદ્યના દરવાજા સુરત–૩૯૫૦૦૨, ભારત ગંગાબેન મારવાડી / સ્થિનભાઈ મારવાડી મહેન્દ્ર વસવા / ઉમેશભાઈ સોલંકી નવિન / ડાહ્યાભાઈ	12.61 12.95 (Ras val: Ras val:
6 7 8 9 10 <b>vol</b> 11	30968740000190	ગોપાલ પરીઠર / પ્રેમપાલસિંઠ ગ્સ બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨ દાનંજ્ય સોની / સુરેશકુમાર રીતાબેન ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઈ / દશરથભાઈ નાન્સ બેંક લીમીટેડ, પહેલો માળ, શિવાલીક કોમ્પલે ~ ૧ અને એફ ~ ર, નારાષ્ટાપુરા, અમીકુંજ કોસ સેડ, ોસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–૩૮૦૦૧૩. ભારત સપના / પુતાનસિંઠ સંદિપદુમાર તિવારી / શીવકુમાર કં લીમીટેડ, પહેલો માળ, નં. ૨૧, ૨૨, ૨૩, રૂદ્રા ગીન કોર્ટ પાસે, નારોલ, અમદાવાદ–૩૮૨૪૫, ભારત. શાહ હરેશકુમાર / અમૃતલાલ સ બેંક લીમીટેડ, રૂમ નં. ૧૦૧, પહેલો માળ, સિગ્મા વિસત પેટ્રોલ પંપ પાસે, સર્વે નં. ૨૨૪૨૪) ની ટી પી ન	35.06 Ha, 340. 23.53 15.32 58.67 4.47 8.81 of Shudag, 30.10 20.10 20.10	31 32 33 33 34 35 36 37	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 iii સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ટ 45248740000034 4524874000086 જના સ્મોલ ફ ઝલોક બિઝનેસ સ ઝુરત સીટી, 30538730005906 30538730006807 30538730006807	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા પુજા ચૌધરી / રાહુલભાઈ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ ોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઈ ધાકેવા દનશ્યામભાઈ / દાહ્યાભાઈ ધાકેવા લગ્લ્યામભાઈ / ડાહ્યાભાઈ ધાકે લીમીટેડ, પ્રાઉન્જ અને પહેલો માળ નગ્રર તરીકે જાણીતી, શોપ નં. ૧ અને ૨, પ્લોટ નં. રીંગ રોડ, ઉદ્યના દરવાજા સુરત–૩૯૫૦૦૨, ભારત ગંગાબેન મારવાડી / સ્થિનભાઈ મારવાડી મહેન્દ્ર વસવા / ઉમેશભાઈ સોલેકી નવિન / ડાહ્યાભાઈ મોહેની ગોખલે / રામચંદ્ર	12.61 12.95 Reas val: Reas
5 6 7 8 9 10 <b>vol</b> 11	30968740000190	ગોપાલ પરીઠર / પ્રેમપાલસિંઠ ગ્સ બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨ દાનંજ્ય સોની / સુરેશકુમાર રીતાબેન ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઈ / દશરથભાઈ નાન્સ બેંક લીમીટેડ, પહેલો માળ, શિવાલીક કોમ્પલે ~ ૧ અને ગેફ ~ ર, નારાષ્ટાપુરા, અમીકુંજ ક્રોસ રોડ, ોસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–૩૮૦૦૧૩. ભારત સપના / પુતાનસિંઠ સંદિપકુમાર તિવારી / શીવકુમાર કંદ લીમીટેડ, પહેલો માળ, નં. ૨૧, ૨૨, ૨૩, રૂવ્ર ગ્રી કોર્ટ પાસે, નારોલ, અમદાવાદ–૩૮૨૪૦૫, ભારત. શાહ હરેશકુમાર / અમૃતલાલ સ બેંક લીમીટેડ, રૂમ નં. ૧૦૧, પહેલો માળ, સિગ્મા વિસત પેટ્રોલ પંપ પાસે, સર્વે નં. ૨૨૪૪૨૫ ી ટી પી ન તલ પ્લોટ નં. ૧૪૧/૦૪, ગ્રાંદખેડા–૩૮૮૪૨૪૨૪	35.06 મોલ, 3પo. 23.53 15.32 58.67 તેસ, 4.47 8.81 ज કોમ્પલેસ, 30.10 આર્કેડ, i. ૨૧,	31 32 33 33 34 35 36 37	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 ા સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ટ 4524874000084 4524874000086 જના સ્મોલ ફ સ્લોક બિઝનેસ સે સુરત સીટી, 30538730005906 30538730006731 30538730006807 30538730007098	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા પુજા શોધરી / રાહુલભાઈ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ ોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઈ ધાટેચા દાનશ્યામભાઈ / દાનશ્યામભાઈ ધાટેચા દાનશ્યામભાઈ / દાનશ્યામભાઈ ધાટે કા લીથીનેટેડ, ગ્રાઉન્ડ અને પહેલો માળ ાન્ટર તરીકે જાણીતી, શોપ નં. ૧ અને ૨, પ્લોટ નં. રીંગ રોડ, ઉદાના દરવાજા સુરત–૩૯૫૦૦૨, ભારત ગંગાબેન મારવાડી / કિશનભાઈ મારવાડી મહેન્દ્ર નવરા / ઉમેશભાઈ સોલંકી નવિન / ડાહ્યાભાઈ મોહેની ગોખલે / રામચંદ્ર ાનસ બેંક લીમીટેડ, પહેલો માળ, નં. ૧૦૧, ૧૦૨, ૧	12.61 12.95 Rects val: 27.04 70.88 32C, 1 8 8.05 9.36 15.49 264.94 264.94
5 6 7 8 9 10 <b>sou</b> 11	30968740000190	ગોપાલ પરીહર / પ્રેમપાલસિંહ ગ્લ બેંક લીમીટેક, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨ દાગંભ્ય રોગી / સુરેશકુમાર સીતાબેગ ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઈ / દશરથભાઈ ગાન્સ બેંક લીમીટેક, પહેલો માળ, શિવાલીક કોમ્પલે - ૧ અને એફ – ૨, નારણપુરા, અમીકુંજ ક્રોસ રોડ, પ્રેસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–3૮૦૦૧૩. ભારત સાયના / પુતાનસિંહ સંદિપકુમાર તિવારી / શીવકુમાર સંદીય ક્લોમીટેક, પહેલો માળ, નં. ૨૧, ૨૨, ૨૩, રૂઘ્ન ગ્રીન કોર્ટ પાસે, નારોલ, અમદાવાદ–3૮૨૨૪૦૫, ભારત. શાહ હરેશકુમાર / અમૃતલાલ સાબેક લીમીટેક, રૂમ નં. ૧૦૧, પહેલો માળ, સિગ્મા વિસત પેટ્રોલ પંપ પાસે, સર્વે નં. ૨૨૪૭૪મ-બી ટી પી ન નલ પ્લોટ નં. ૧૪૧/૦૪, શાંદખેડા–૩૮૮૪૪૪	35.06         भोख,         3uo.         23.53         15.32         58.67         नेक्ष,         4.47         8.81         ज डोम्पलेक्ष,         30.10         आर्डs,         46.82	31 32 33 33 34 35 36 37	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 II સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ર 45248740000034 4524874000086 જના સ્મોલ ફ જલોક બિઝનેસ સે સુરત સીટી, 30538730006907 30538730006807 30538730006807 30538730006807	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજા પુજા ચૌધરી / રાહુલભાઈ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ ોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઈ ધાકેવા દનશ્યામભાઈ / દાહ્યાભાઈ ધાકેવા લગ્લ્યામભાઈ / ડાહ્યાભાઈ ધાકે લીમીટેડ, પ્રાઉન્જ અને પહેલો માળ નગ્રર તરીકે જાણીતી, શોપ નં. ૧ અને ૨, પ્લોટ નં. રીંગ રોડ, ઉદ્યના દરવાજા સુરત–૩૯૫૦૦૨, ભારત ગંગાબેન મારવાડી / સ્થિનભાઈ મારવાડી મહેન્દ્ર વસવા / ઉમેશભાઈ સોલંકી નવિન / ડાહ્યાભાઈ મોહિની ગોખલે / રામચંદ્ર	12.61 12.95 Rects val: 27.04 70.88 32C, 1 8 8.05 9.36 15.49 264.94 264.94
5 6 7 8 9 10 <b>sou</b> 11	30968740000190	ગોપાલ પરીઠર / પ્રેમપાલસિંઠ ગ્સ બેંક લીમીટેડ, એ/૭, ત્રીજો માળ, સરદાર પટેલ બ્રીજ પાસે, નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ–૩૮૨ દાનંજ્ય સોની / સુરેશકુમાર રીતાબેન ઠાકોર / હિરાજી ઠાકોર દશરથભાઈ / દશરથભાઈ નાન્સ બેંક લીમીટેડ, પહેલો માળ, શિવાલીક કોમ્પલે ~ ૧ અને ગેફ ~ ર, નારાષ્ટાપુરા, અમીકુંજ ક્રોસ રોડ, ોસ્ટ ઓફીસ પાસે, અમદાવાદ–૩૮૦૦૧૩. ભારત સપના / પુતાનસિંઠ સંદિપકુમાર તિવારી / શીવકુમાર કંદ લીમીટેડ, પહેલો માળ, નં. ૨૧, ૨૨, ૨૩, રૂવ્ર ગ્રી કોર્ટ પાસે, નારોલ, અમદાવાદ–૩૮૨૪૦૫, ભારત. શાહ હરેશકુમાર / અમૃતલાલ સ બેંક લીમીટેડ, રૂમ નં. ૧૦૧, પહેલો માળ, સિગ્મા વિસત પેટ્રોલ પંપ પાસે, સર્વે નં. ૨૨૪૪૨૫ ી ટી પી ન તલ પ્લોટ નં. ૧૪૧/૦૪, ગ્રાંદખેડા–૩૮૮૪૨૪૨૪	35.06         भोख,         3uo.         23.53         15.32         58.67         नेक्ष,         4.47         8.81         ज डोम्पलेक्ष,         30.10         आर्डs,         46.82	31 32 33 33 34 35 36 37	કેકેવી સર્કલ 33538740000110 33538740000136 II સ્મોલ ફાચનાન્સ બેં વોર્ડ નં. ૩૫૬, ર 45248740000034 4524874000086 જના સ્મોલ ફ જલોક બિઝનેસ સે સુરત સીટી, 30538730006907 30538730006807 30538730006807 30538730006807	ા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ–૩૬૦૦૦૫, ભારત ચસ્મીનબાનુ શેખ / જુમન મીરજ પુજા શોધરી / રાહુલભાઈ ક લીમીટેડ, પ્લોટ નં. ૪૦૭, ૪૦૮, ચોથો માળ, સ્વ દોગી ચોક, વરાછા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬, ભા પટેલ જીગ્નેશ / ડાહ્યાભાઈ દાકેશા દાનશ્યામભાઈ / દાનશ્યામભાઈ દાકે લીમીટેડ, ગ્રાઉન્ડ અને પહેલો માળ ન્વટર તરીકે જાણીતી, શોપ નં. ૧ અને ૨, પ્લોટ નં. ર્ટીંગ રોડ, ઉદ્યના દરવાજા સુરત–૩૯૫૦૦૨, ભારત ગંગાબેન મારવાડી / હિશનભાઈ મારવાડી મહેન્દ્ર વસવા / ઉમેશભાઈ સોલંકી નવિન / ડાહ્યાભાઈ મોહેની ગોખલે / ટાશ્યંદ્ર ધાન્લ્સ બેંક લીમીટેડ, પહેલો માળ, નં. ૧૦૧, ૧૦૨, ૧ માન્લેસ, એક્સીસ બેંક સામે, દિપ ચેમ્બર્સ ક્રોસ રોડ	12.61 12.95 Ras val: Ras val:

13 33998730002940

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY AND IS NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES. NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION DIRECTLY OR INDIRECTLY OUTSIDE INDIA. **PUBLIC ANNOUNCEMENT** 





## **NUVOCO VISTAS CORPORATION LIMITED**

Nuvoco Vistas Corporation Limited ("our Company" or "the Company") was originally incorporated on February 8, 1999 as a private limited company under the Companies Act, 1956, with the name "Infra Ceme the investment in our Company by the erstwhile shareholders in the year 1999 and the resolution dated May 19, 1999 passed by the Shareholders, the name of our Company was changed to "Lafarge India Private Limited", and a fresh certificate of incorporation was issued upon the change of name by the Registrar of Companies, Maharashtra at Mumbai ("RoC") on May 25, 1999. Pursuant to Section 43A(1) of the Companies Act, 1956, our Company became a deemed public limited company with effect from November 2, 1999 and the certificate of incorporation of our Company was endorsed by the RoC to that effect, and this was noted in the resolution dated December 3, 1999 passed by the Board. Subsequently, pursuant to the resolution dated April 16, 2003 passed by the Shareholders, the status of our Company was changed from deemed public limited company to private limited company in terms of Section 43A(2A) of the Companies Act, 1956. Accordingly, our Company became a private limited company with effect from April 16, 2003 and the certificate of incorporation of our Company was endorsed by the RoC to that effect. Thereafter, pursuant to the resolution dated February 26, 2016 passed by the Shareholders, our Company was once again converted to a public limited company resulting in the change of name to "Lafarge India Limited" and a fresh certificate of incorporation was issued by the RoC on March 12, 2016. Pursuant to divestment by the erstwhile shareholders in our Company in the year 2016 and the resolution dated March 8, 2017 passed by the Shareholders, the name of our Company was changed to "Nuvoco Vistas Corporation Limited" and a fresh certificate of incorporation was issued by the RoC on March 10, 2017. For details of the change in the name and the registered office of our Company, see "History and Certain Corporate Matters" on page 203 of the draft red herring prospectus dated May 6, 2021 ("DRHP").

#### Corporate Identity Number: U26940MH1999PLC118229

Registered and Corporate Office: Equinox Business Park, Tower 3, East Wing, 4\* Floor, LBS Marg, Kurla (West), Mumbai - 400 070, Maharashtra, India; Tel: +91 22 6769 2500; Contact Person: Shruta Sanghavi, Company Secretary and Compliance Officer, Tel: +91 22 6630 6511; E-mail: investor.relations@nuvoco.com; Website: www.nuvoco.com

## OUR PROMOTERS: NIYOGI ENTERPRISE PRIVATE LIMITED AND DR. KARSANBHAI K. PATEL

INITIAL PUBLIC OFFERING OF UP TO [●] EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH ("EQUITY SHARES") OF NUVOCO VISTAS CORPORATION LIMITED ("COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ [●] PER EQUITY SHARE (INCLUDING A SHARE PREMIUM OF ₹ [•] PER EQUITY SHARE) ("OFFER PRICE") AGGREGATING UP TO ₹ 50,000.00 MILLION COMPRISING A FRESH ISSUE OF UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹ 15,000.00 MILLION ("FRESH ISSUE") AND AN OFFER FOR SALE OF UP TO [•] EQUITY SHARES BY NIYOGI ENTERPRISE PRIVATE LIMITED ("PROMOTER SELLING SHAREHOLDER") AGGREGATING UP TO ₹ 35,000.00 MILLION FFERED SHARES") ("OFFER FOR SALE". AND TOGETHER WITH THE FRESH ISSUE. THE "OFFER"). THE OFFER SHALL CONSTITUTE I=1% OF THE POST-OFFER PAID UP EQUITY SHARE CAPITAL OF OUR CON

રીશીત વિમાવાળા. સ્થળ : અમદાવાદ હોલટાઇમ ડાચરેક્ટર. รใดเงรมงระหะ તારીખ : ૦૬.૦૫.૨૦૨૧ बी ई एम एल बीईएमएल लिमिटेड BEML Limited Frite (Schedule A Company under Ministry of Defence) CIN: L35202KA1964GOI001530 Regd. Office: "BEML Soudha", No.23/1, 4th Main Road, S.R. Nagar, Bengaluru - 560 027 Ph : (080) 22963142, E-mail: cs@beml.co.in, Web-site : www.bemlindia.in Notice is hereby given that the following share certificate have been reported lost/ misplaced and the holder of the share certificate have applied with the Company for issue of duplicate share certificate: Name of No of Distinctive Folio No. Cert. No. Shareholde Shares Nos. ASHISH BES800409 92198-92242 4500 35219701-35224200 NIJHAWAN Objections, if any, may please be lodged with the Company at the above address within 15 days from the date of publication of this notice. Please note that, if no objection is received within the said period, the Company will proceed further with issuing the duplicate share certificate to the applicant/shareholde For BEML LIMITED Sd/-S V Ravisekhar Rao Company Secretary Bengaluru Date: 07.05.2021 કોર્મ એ સાર્વજનિક જાહેરાત (ઇનસોલ્વન્સી અને બેન્ક્રપ્ટસી બોર્ડ ઓફ ઇન્ડિયા (કોર્પોરેટ પર્સન માટે ઇનસોલ્વન્સી રીઝોલ્યુશન પ્રોસેસ) નિચમનો, ૨૦૧૬ ના નિચમન ૬ હેઠળ) ડિસન્ટ લેમિનેટ પ્રાઇવેટ લીમીટેડના ક્રેડીટરોની જાણકારી માટે સબંદ્યિત વિગતો ડિસન્ટ લેમિનેટ પ્રાઇવેટ લીમીટેડ . કોર્પોરેટ દેવાદારનું નામ . કોર્પોરેટ દેવાદારનાં સુસ્થાપનની તારીપ ૩૧/૧૦/૧૯૮૫ <u>નોથોરીટી જેના હેઠળ કોર્પોરેટ દેવાદા</u> કંપનીઓના રજીસ્ટ્રાર- ગુજરાત ઇનકોર્પોરેટેડ/રજીસ્ટર્ડ છે (આરઓસી), અમદાવાદ કોર્પોરેટ દેવાદારનો કોર્પોરેટ ઓળખ નંબર U20219GJ1985PTC008230 લીમીટેડ લાયબીલીટી આઇડેન્ટીફીકેશન નંબર

કોર્પોરેટ દેવાદારની રજીસ્ટર્ડ ઓફીસ અને મુખ્ય ર**જીસ્ટર્ડ ઓફીસ :** ૪૦૧, હરિકૃપા ટાવર, એલિસબ્રિલ ઓફીસ (જો કોઇ હોય તો) તેનું સરનામું અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૦૬ પ્રીન્સિપલ ઓફીસ : સર્વે નં. ૪૩/૧, કલોલ મહેસાણા હાઇવે, નંદાસણ, મહેસાણા, ગુજરાત. કોર્પોરેટ દેવાદારના સંદર્ભમાં ઇનસોલ્વન્સ 03/04/2029 (આદેશ ૦૬/૦૫/૨૦૨૧ ના રોજ મળ્યો હતો.) શરૂઆતની તારીખ ડનસોલ્વનસી રીઝોલ્યુશન પ્રક્રિયાન 02/99/2029 સમાપ્તિની અંદાજિત તારીખ વચગાળાના રીઝોલ્યુશન પ્રોફેશનલ તરી જયકુમાર પેસુમલ અરલાણ કાર્યરત ઇનસોલ્વન્સી પ્રોક્શનલના નામ રજીસ્ટ્રેશન નંબર : IBBI/IPA-001/IP-P01582/2018-2019/12443 અને રજીસ્ટ્રેશન નંબર વચગાળાના રીઝોલ્યુશન પ્રોફેશનલનું સરનામું અરલાણી નિવાસ, ૧૦, ગાયકવાડી, જંકશન પ્લોટ રાજકોટ-૩૬૦૦૦૧ **ઇમેઇલ** : arlanijay@gmail.com અને ઇમેઇલ બોર્ડમાં રજીસ્ટર્ડ છે તે અનુસાર વચગાળાના રીઝોલ્યુશન પ્રોફેશનલ સાથે ૩૦૫-૬, પારુલ કોમ્પલેક્ષ, સંત કબિર રોડ પત્રવ્યવહાર માટેનું સરનામું અને ઇમેઇલ રાજકોટ-૩૬૦૦૦૩ ઇમેઇલ : ip.arlanijay@gmail.com દાવાઓની સુપરતગીની છેલ્લી તારીખ 20/04/2029 ક્રેડિટરોના વર્ગ, જો કોઇ હોય તો, કલમ ર ૧ની પેટા કલમ(છ એ) ની ઘારા(બી) હેઠળ, હાલ લાગુ નથી ચગાળાના ઠરાવ પ્રોકેશનલની સહમતીથી . વર્ગમાં ક્રેડિટરોના અધિકૃત પ્રતિનિધિ ૨. હાલ લાગુ નથી. તરીકે કાર્યરત ઇનસોલ્વન્સી પ્રોફેશનલસન નામો (દરેક ક્લાસદીઠ ત્રણ નામો) વેબલિંકઃ <u>https://ibbi.gov.in/home/downloads</u> (એ) સબંધિત કોર્મ અને (બી) અધિકત પ્રતિનિધિઓની વિગતો ઉપલબ્ધ છે: સરનામું : વિગત નંબર ૯

નાથી નોટીસ આપવામાં આવે છે કે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે આદેશ નં. સીપી(આઇબી) ૩ ૩૭/૯/એનસીએલટી ોએચએમ/ ૨૦૨૦ હારા ૦૩/૦૫/૨૦૨૧ ના રોજ ડિસન્ટ લેમિનેટ પ્રાઇવેટ લીમીટેડની કોર્પોરેટ ઇન્સોલ્વેન્સી રીઝોલ્યુશન પ્રક્રિયાની શરૂઆતનો આદેશ આપ્યો છે.

**ડિસન્ટ લેમિનેટ પ્રાઇવેટ લીમીટેડના** ક્રેડિટરોને ૨૦/૦૫/૨૦૨૧ ના રોજ અથવા તે પહેલા વિગત નં. ૧૦ સ જણાવેલ સરનામા પર ઇન્ટીમ રીઝોલ્યુશન પ્રોફ્શનલને પુરાવા સહીત તેમના દાવાઓ સુપરત કરવા જણાવામાં આવે છે નાણાંકિય ક્રેડિટરો ફક્ત ઇલેક્ટોનિક માધ્યમો દ્વારા પરાવા સાથે તેમના દાવાઓ સપરત કરી શકશે. અન્ય તમામ ક્રેડિટ તતે, અથવા પોસ્ટ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પુરાવા સાથે દાવાઓ સુપરત કરી શકે છે. ખોટા અને ગેરમાર્ગે દોરતા પુરાવાઓની સુપરતગી દંડને પાત્ર બનશે.

સ્થળઃ અમદાવાદ

તારીખ: ૦૬.૦૫.૨૦૨૧ ઇન્ટ્રીમ રીઝોલ્યુશન પ્રોફેશનલનું નામ અને સહી જ્યકુમાર પેસુમલ અરલાણી 10.00

રમેશભાઈ રબારી / અર્જનભાઈ રબારી

માંગણા નોટીસ જ્ત જ્ણાવવાનું કે એસેટ સેક્ન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમેટેક અઢીપછી આર્સિલ તરીકે વર્ણવેલ છે જે કંપન કાચદા, ૧૯૫૬ હેઠળ સંસ્થાપિત સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટક્શન કંપની છે અને સિક્યોરીટાઇઝેશન અ રીકન્સ્ટક્શન ઓક કાચનાન્સિચલ એસેટ અને એનકોર્સમેન્ટ ઓક સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ (અ પછી કાચદા તરીકે વર્ણવેલ છે) ની કલમ ૩ હેઠળ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં રજીસ્ટર્ડ છે જેના અધિકૃત અધિકાર અને જ્ત જણાવવાનું કે નીચે જણાવેલ ચાર્ટની કોલમ રમાં જણાવ્યા અનુસાર દેવાદારો/સહ-દેવાદારોએ વિવિ બેંકો તરફથી લોન મેળવી છે અને જ્ત જણાવવાનું કે આર્સિલ નીચે જણાવેલ ચાર્ટની કોલમ રમાં જણાવેલ લોન ખાતાઓના સબંધમાં નાણાંકિય સહાય હસ્તગત કરી છે અને જા જણાવવાનં કે કાયદા હેઠળ આર્સિલ સિક્યો: લેણદાર બને છે અને જણાવેલ કાયદાની કલમ ૧૩ (૨) ને સિક્યોર્ડ ઇન્ટરેસ્ટ(એનફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ નિચમ ૨ સાથે લઇને તે હેઠળ મળેલી સત્તાની ૩એ કોલમ નં. ૨માં જણાવેલ દેવાદારો/સહ–દેવાદારોને નોટીસન તારીખથી ૬૦ દિવસની અંદર નોટીસોમાં જણાવેલ રકમ અને ચડત વ્યાજસહિત ચુકવી જવા માટે માંગણા નોટીર પાઠવી હતી, પરંતુ નોટીસોની વિવિધ કારણોસર બજવણી થઇ શકી ન હતી.

ક્રમ નં.	દેવાદાર/સહ–દેવાદારનું નામ લોન એકાઉન્ટ નંબર/ સેલીંગ બેંક	કુલ બાકી લેણું (રૂા.)માં અંતિમ તારીખ
۹.	શ્રી રાજેશકુમાર વી.ઠક્કર / શ્રીમતી વૈશાલીબેન આર.ઠક્કર /	૧૮.૦૨.૨૦૨૧ નાં રોજ
	496RLP47314654 / બજાજ ફાચનાન્સ લીમીટેડ	રૂા. ૧,૩૮,૯૪,૭૩૨.૯૦/–

ા ગળતા માટે પ્રિલકતનું સરનામું : (૧) પ્લોટ નં. રવ, સર્વે નં. ૮૬૬/૧ પૈકી, જીવરાજપાર્ક સોસાચેટી, પદ્મગાથ મંદિર રોડ, મીરા દરવાજા, ગુંગાદીપત્તી તાલુકો અને જીક્ષે પાટણ–૩૮૪૨૬૫, ગુજરાત. (૨) પ્લોટ નં. ૨૨, સર્વે નં. ૧૦૯૨ પૈકી ૧, ડોલ્ફીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રીવર ફ્રન્ટ સીટી, પાટણ રોડ, જેસામલપત્તી, તાલુકો અને જીક્ષો પાટણ–૩૮૪૨૬૫, ગુજરાત. (૩) પ્લોટ નં. ૨૩, સર્વે નં. ૧૦૯૨ માંગ દાંગલેલ્લા, લાવુડા છાંગ બાલ પાઇલ-૩ઇશ્ફર, વુગરદાંગ 5, ગાલ ગાર કા, દાંગ જ ગાય કે, દાંગ જ ગાય કે, દાંગ જ ગાય પીકી ૧, ડોલ્ફીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સીવર ફન્ટ સીટી, પાટણ દોડ, મોંગેસામલપત્તી લાવુકો અને છુલી પાટણ-૩૮૪૨૬૫, ગુજરાત. (૪) પ્લોટ નં. હ૮, સર્વે નં. ૧૦૯૨ પૈકી ૧, ડોલ્ફીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રીવર ફન્ટ સીટી, પાટણ રોડ, મોંગેસામલપત્તી લાલુકો અને છુલો પાટણ-૩૮૪૨૬૫, ગુજરાત. (૫) પ્લોટ નં. ૧૦૧, સર્વે નં. ૧૦૯૨ પૈકી ૧, ડોલ્ફીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રીવર ફન્ટ સીટી, પાટણ દોડ, મોંગે સામલપત્તી તાલુકો અને જીલો પાટણ-૩૮૪૨૬૫, ગુજરાત. (૬) પ્લોટ નં. ૫૦, સર્વે નં. ૯૧૪ પૈકી ૨, બાલાજી વીલા, નિર્માણ નગર, રેલ્વે કોર્સીંગ પાસે, ચણાસ્મા હાઇવે, પાટુણ રોડ, મોજે ર, બાલાજી વીલા, નિર્માણ નગર, રેલ્વે ક્રેસીંગ પાસે, ચણાસ્માં હાઇવે, પાટણ રોડ, મોબે ગુંગાદીપત્તી તાલુકો અને જીક્ષો પાટણ-૩૮૪૨૬૫, ગુજરાત. (૭) પ્લોટ નં. ૫૦, સર્વે નં. ૯૧૪ પૈકી ૨, બાલાજી વીલા, નિર્માણ નગર, રેલ્વે ક્રોસીંગ પાસે, ચણાસ્માં હાઇવે, પાટણ રોડ, મોબે ગુંગાદીપત્તી, તાલુકો અને જીક્ષો પાટણ-૩૮૪૨૬૫, ગુજરાત.

શ્રી શ્રેણીક સનતકુમાર ઝવેરી / શ્રીમતી શ્રેણીક ઝવેરી / ૨૪.૦૨.૨૦૨૧ નાં રોજ 418CSH00281354/418CSH00274978/418CSH00274979 રા. ૯૮,૧૬,૯૯૬.૪૮/-બજાજ કારાનાન્સ લીમીટેડ

સિક્ચોર્ડ મિલકતનું સરનામું : ફ્લેટ ન. ડી-૩૦૩ ક્ષેત્રફળ ૨૦૦.૬૭ ચો.મી., ત્રીજો માળ (બીજો માળ એપ્રુવ્ડ પ્લાન મુજબ) બ્લોક નં. ડી, સ્કીમ ગાલા સ્વીંગ, બાંધકામ બ્લોક નં. ૪૬૩, ૪૭૪, ૪૭૫, ૪૭૬+૪૭૭એ, ૪૭૬+૪૭૭બી, ૪૮૭, ૪૯૦, ૪૯૨, ૪૯૩, ૪૯૪, ૪૯૫, ૪૯૭ અને ૪૯૯ સેત્ર ફળ ૧૪૪૬૮+૭૯૯૩+૧૫૧૮+૧૨૬૭૮+૪૨૪૯+૫૪૬૩+૨૮૩૨+૮૮૦૨+૫૧૬૦+૬૦૭૦+૨૨૨૬+૪૧૪ ૮+૧૩૧૫૩ તેમજ ક્ષેત્રફળ ૮૮૭૬૧ ચો.મી. અને બ્લોક નં. ૪૯૬ ક્ષેત્રફળ ૨૮૩૩ ચો.મી., મોજે-બોપલ, જિહ્યો–૯ (બોપલ), જિહ્યો–અમદાવાદ–૩૮૦૦૫૮, ગુજરાત.

શ્રી ભગારામ ચમનરામ દરોગા / શ્રીમતી મંજુલાબેન દરોગા / મેસર્સ ગુજરાત ૧૯.૦૨.૨૦૨૧ નાં રોવ સ્ટીલ ઈન્ડીચા / 4180HL35357853 / 4180HL35243880 / બજાજ 31.8.84.643.40/-ાનાન્સ લીમીટેડ

સિક્ચોર્ડ મિલકતનું સરનામું : ૧.) ફ્લેટ નં. ૨૦૪, બીજો માળ, (પહેલો માળ એએમસીના એપ્રુવ્ડ પ્લાન મુજબ) બ્લોકે–સી, સરફેસ પેરાડાઇઝ, તક્ષશીલા સ્કુલ માત્રે, રેવન્યુ સર્વે નં. ૩૭૪, ખાત નં. ૧૪૨, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૧૦૪, ફાઇનલ પ્લોટ નં. ૧૬, ગોર્વધન પાર્ક પાછળ, અર્બુદ આ ૧૬૧, દાઇવ પ્લાપાય કરાન ગ. ૧૯૬, સાઇવેલ પાટ બા ૧૬, ગાવવા પાક પાઇપા, અપુદા નગર દોડ, મોલે-ઓટવ, અમદાવાદ-૩૮૨૪૧૫, ગુજરાત. ૨.)ફ્લેટ નં. ૪૦૪, ચોથો માળા,(ગ્રીળે માળ એએમસી એપ્રુપ્ડ પ્લાન મુલ્બ), બ્લોક-સી, સરફેસ પેરાડાઇઝ, તસશીલા સ્કુલ સામે, રેવન્થુ સર્વે નં. ૩૭૪, ખાતા નં. ૧૪૨, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૧૦૪, ફાઇનલ પ્લોટ નં. ૧૬, ગોર્વધન પાર્ક પાછળ, અર્બુદા નગર રોડ, મોલે-ઓટવ, અમદાવાદ-૩૮૨૪૧૫, ગુજરાત. ૪. શ્રી કિશોરકુમાર એલ. દામોર / શ્રીમતી સ્નેહા કિશોર દામોર / ૧૮.૦૨.૨૦૨૧ નાં રોજ

500RLD30569559 / બજાજ ફાચનાન્સ લીમીટેડ રૂા.૧૭,૧૧,૪૮૫.૧૭/-સિક્ચોર્ડ મિલકતનું સરનામું : માઁ હોસ્પિટલ, પહેલો માળ, બીજો અને ત્રીજો માળ, મધુવન આર્કેડ, પંચાયત પ્રોપર્ટી નં. ૩૮૦, સર્વે નં. ૧૩૬ પૈકી ૨ જ્મીન (નવો નંબર ૧૩૭)પૈકી, કાર્પેટ એરિયા પ્લોટ નં. ૧ થી ૬ની જ્મીન, ગામ–શામલપુર, ભીલોડા રોડ, તાલુકો–ભીલોડા, જિલો–અરવલી,

શામળાજી–૩૮૩૩૫૫, ગુજરાત. પરિણામે કોલમ ન ૨માં જણાવેલ દેવાદારો/સહ–દેવાદારોને સબંધિત દેવાદારો/સહ–દેવાદારો સાથ

કોલમ નં. 3માં જણાવેલ સંપુર્ણ ૨કમની ચુક્વણી આ નોટીસની પ્રકાશનની તારીખથી ૬૦ દિવસની અંદર કોલમ નં.૩ માં જણાવેલ વિગતો અનુસાર સંબંધિત લોન એકાઉન્ટના સબંધમાં ચુકવવાપા જણાતી જણાવેલ ૨કમ ચુકવી જવા માટે જણાવવામાં આવે છે. તે સ્પષ્ટ છે કે જો ચુકવણીની તારીખ સુધી ચુક્વવા પાત્ર બનતી સંપૂર્ણ ૨કમ તેના પરના અન્ય વ્યાજઅને અન્ય રકમો સહિત ચુક્વવામ નહી આવે તો, આર્સિલને ઉપર જણાવેલ મિલક્તો ઉપર સિક્યોર્ડ ઇન્ટરેસ્ટનાં એનફોર્સમેન્ટ માટેન ચોગ્ચ પગલા લેવાની કરજ પડશે. કાયદા અને નિચમો હેઠળ જણાવેલ અન્ય પદ્ધતિઓર્થ નોટીસની બજ્વણી કરવાના પગલા પણ લેવાચા છે.

સ્થળ : ગુજરાત તારીખ : ૦૭.૦૫.૨૦૨૧

સહી/– અધિકૃત અધિકારી એસેટ રિકન્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમીટેડ

એસેટ રિકન્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમીટેડ Arcil CIN:U65999MH2002PLC134884 - વેબસાઇટ: www.arcil.co.in

<u>૨જીસ્ટર્ડ ઓફીસ :</u> ધ રૂબી, ૧૦મો માળ, ૨૯ સેનાપતી બાપટ માર્ગ, દાદ૨ (પશ્ચિમ) મુંબઇ-૪૦૦૦૨૮, ફોન : ૦૨૨-૬૬૫૮૧૩૦

. શાખાનું સરનામું : ૬૧૦, ૬ઠ્ઠો માળ, સન સ્ક્વેર, હોટેલ રેગેન્ટા સેન્ટ્રલ એન્ટ્રીમ, સી.છ. રોડ પર નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૬, ગુજરાત. ફોન: ૦૭૯–૪૦૩૦૬૩૦૧ / ૦૨

THE PRICE BAND AND THE MINIMUM BID LOT WILL BE DETERMINED BY OUR COMPANY AND THE PROMOTER SELLING SHAREHOLDER, IN CONSULTATION WITH THE BOOK RUNNING LEAD MANAGERS AND WILL BE MARATHI NATIONAL NEWSPAPER, MARATHI BEING THE REGIONAL LANGUAGE OF MAHARASHTRA, WHERE THE REGISTERED AND CORPORATE OFFICE IS LOCATED) AT LEAST TWO WORKING DAYS PRIOR TO THE BID/OFFER OPENING DATE AND SHALL BE MADE AVAILABLE TO BSE LIMITED ("BSE") AND NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED ("NSE" AND TOGETHER WITH BSE, THE "STOCK EXCHANGES") FOR UPLOADING ON THEIR RESPECTIVE WEBSITES IN ACCORDANCE WITH THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018, AS AMENDED ("SEBI ICDR REGULATIONS").

#### THE FACE VALUE OF THE EQUITY SHARES IS ₹ 10 EACH AND THE OFFER PRICE IS [●] TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES

In case of a revision in the Price Band, the Bid/Offer Period will be extended for at least three additional Working Days after such revision of the Price Band subject to the Bid/Offer Period not exceeding a total of 10 Working Days. In cases of force majeure, banking strike or similar circumstances, our Company may, for reasons to be recorded in writing, extend the Bid/Offer Period for a minimum of three Working Days, subject to the Bid/Offer Period not exceeding 10 Working Days. Any revision in the Price Band and the revised Bid/Offer Period, if applicable, will be widely disseminated by notification to the Stock Exchanges, by issuing a press release, and also by indicating the change on the websites of the Book Running Lead Managers and at the terminals of the other members of the Syndicate. The Offer is being made in terms of Rule 19(2)(b) of the Securities Contracts (Regulation) Rules, 1957, as amended, ("SCRR") read with Regulation 31 of the SEBI ICDR Regulations. The Offer is being made through the Book Building Process, in compliance with Regulation 6(1) of the SEBI ICDR Regulations, where not more than 50% of the Offer shall be available for allocation on a proportionate basis to Qualified Institutional Buyers ("QIBs") ("QIB Category"), provided that our Company and the Promoter Selling Shareholder, in consultation with the Book Running Lead Managers, may allocate up to 60% of the QIB Category to Anchor Investors, on a discretionary basis ("Anchor Investor Portion"), of which one-third shall be reserved for domestic Mutual Funds, subject to valid Bids being received

from domestic Mutual Funds at or above the price at which Equity Shares are allocated to Anchor Investors. In the event of under-subscription, or non-allocation in the Anchor Investor Portion, the balance Equity Shares shall be added to the QIB Category. Post allocation to the Anchor Investors, the QIB Category will be reduced by such number of Equity Shares. Further, 5% of the QIB Category (excluding the Anchor Investor Portion) shall be available for allocation on a proportionate basis to Mutual Funds only and the remainder of the QIB Category shall be available for allocation on a proportionate basis to all QIBs (other than Anchor Investors), including Mutual Funds, subject to valid Bids being received at or above the Offer Price. However, if the aggregate demand from Mutual Funds is less than 5% of the QIB Category (excluding the Anchor Investor Portion), the balance Equity Shares available for allocation in the Mutual Fund Portion will be added to the remaining QIB Category (excluding the Anchor Investor Portion) for proportionate allocation to QIBs. Further, not less than 15% of the Offer shall be available for allocation on a proportionate basis to Non-Institutional Investors and not less than 35% of the Offer shall be available for allocation to Retail Individual Investors, in accordance with the SEBI ICDR Regulations, subject to valid Bids being received at or above the Offer Price. All Bidders (other than Anchor Investors) shall mandatonly participate in this Offer through the Application Supported by Block Amount ("ASBA") process, and shall provide details of their respective bank account (including UPI ID for Retail Individual Investors using UPI Mechanism) in which the Bid Amount will be blocked by the SCSBs or the Sponsor Bank, as the case may be. Anchor Investors are not permitted to participate in the Anchor Investor Portion through the ASBA process. For further details, see "Offer Procedure" on page 431 of the DRHP.

This public announcement is being made in compliance with the provisions of Regulation 26(2) of the SEBI ICDR Regulations to inform the public that our Company is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares pursuant to the Offer and has filed the DRHP with the Securities and Exchange Board of India ("SEBI") on May 6, 2021. Pursuant to Regulation 26(1) of the SEBI ICDR Regulations, the DRHP filed with SEBI shall be made public for comments, if any, for a period of at least 21 days from the date of such filing by hosting it on the website of SEBI at www.sebi.gov.in, websites of the Stock Exchanges i.e. NSE and BSE at www.nseindia.com, www.bseindia.com, and the websites of the BRLMs i.e. ICICI Securities Limited, Axis Capital Limited, HSBC Securities and Capital Markets (India) Private Limited, J. P. Morgan India Private Limited and SBI Capital Markets Limited at www.icicisecurities.com, www.axiscapital.co.in, www.business.hsbc.co.in/en-gb/in/generic/ipo-open-offer-and-buyback, www.jpmipl.com and www.sbicaps.com, respectively. Our Company invites the public to give their comments on the DRHP filed with SEBI, with respect to disclosures made in the DRHP. The members of the public are requested to send a copy of the comments sent to SEBI, to the Company Secretary and Compliance Officer of our Company and the BRLMs at their respective addresses mentioned herein. All comments must be received by our Company or the BRLMs at their respective addresses mentioned herein below in relation to the Offer on or before 5.00 p.m. on the 21<sup>st</sup> day from the aforesaid date of filing of the DRHP with SEBI.

Investments in equity and equity-related securities involve a degree of risk and investors should not invest any funds in this Offer unless they can afford to take the risk of losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in this Offer. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Offer, including the risks involved. The Equity Shares have not been recommended or approved by the SEBI, nor does SEBI guarantee the accuracy or adequacy of the contents of the DRHP. Specific attention of the investors is invited to "Risk Factors" on page 25 of the DRHP.

Any decision to invest in the Equity Shares described in the DRHP may only be taken after the Red Herring Prospectus for the same has been filed with the RoC and must be made solely on the basis of such Red Herring Prospectus, as there may be material changes in the Red Herring Prospectus from the DRHP. The Equity Shares, when offered through the Red Herring Prospectus, are proposed to be listed on BSE and NSE.

For details of the share capital and capital structure of the Company, see "Capital Structure" on page 85 of the DRHP. For details of the main objects of the Company as contained in the Memorandum of Association, see "History and Certain Corporate Matters" on page 203 of the DRHP.

BOOK RUNNING LEAD MANAGERS J.P.Morgan 0 HSBC (X) *Vicici* Securities SBI Copital Markets HSBC Securities and Capital Markets (India) Private Limited J. P. Morgan India Private Limited **ICICI Securities Limited Axis Capital Limited** ICICI Centre, H.T. Parekh Marg, 1ª Floor, Axis House, C-2, J.P. Morgan Tower, Off. C.S.T. Road **SBI Capital Markets Limited** Churchgate, Mumbai - 400 020 202, Maker Tower 'E', Cuffe Parade, Wadia International Centre, P. B. Marg, 52/60, Mahatma Gandhi Road, Fort Kalina, Santacruz (East) Mumbai - 400 001 Maharashtra, India Maharashtra, India Worli, Mumbai - 400 025 Mumbai 400 098 Mumbai 400 005 Maharashtra, India Tel: +91 22 2268 5555; E-mail: nuvocoipo@hsbc.co.in Tel: +91 22 2288 2460 Maharashtra, India Tel: +91 22 2217 8300 Maharashtra, India Website: www.business.hsbc.co.in/en-gb/in/ E-mail: nuvoco.ipo@icicisecurities.com Tel: +91 22 4325 2183 Tel: +91 22 6157 3000 E-mail: nuvoco.ipo@sbicap Website: www.icicisecurities.com E-mail: nvcl.ipo@axiscap.in generic/ipo-open-offer-and-buyback E-mail: nuvoco\_ipo@jpmorgan.com Website: www.sbicaps.com Investor Grievance E-mail: Website: www.axiscapital.co.in Website: www.jpmipl.com Investor Grievance e-mail: Investor grievance e-mail: Investor Grievance E-mail: Investor grievance e-mail: customercare@icicisecurities.com investorgrievance@hsbc.co.in nvestor.relations@sbicaps.com Contact person: Mr. Sameer Purohit / complaints@axiscap.in Contact Person: Ms. Sanjana Maniar / investorsmb.jpmipl@jpmorgan.com Contact Person: Mr. Karan Savardekar / Contact Person: Mr. Saarthak K. Soni Contact person: Mr. Pratik Pednekar Mr. Rupesh Khant Mr. Dhananjay Sureka Mr. Gaurav Mittal SEBI Registration No: INM000011179 SEBI Registration No: INM000012029 SEBI Registration No.: INM000010353 SEBI Registration No.: INM000002970 SEBI Registration No.: INM000003531 **REGISTRAR TO THE OFFER** Link Intime India Private Limited C-101, 1st Floor, 247 Park, L. B. S. Marg, Vikhroli West, Mumbai - 400 083 Maharashtra, India. Tel: +91 22 4918 6200; E-mail: nuvoco.ipo@linkintime.co.in; Investor grievance E-mail: nuvoco.ipo@linkintime.co.in; Website: www.linkintime.co.in; Contact Person: Ms. Shanti Gopalkrishnan; SEBI Registration No: INR000004058 All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the DRHP. For NUVOCO VISTAS CORPORATION LIMITED On behalf of the Board of Directors Place : Mumbai Date : May 6, 2021 Company Secretary and Compliance Officer NUVOCO VISTAS CORPORATION LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the

DRHP with SEBI on May 6, 2021. The DRHP will be available on the website of SEBI at www.sebi.gov.in, website of stock exchanges i.e. NSE at www.nseindia.com, BSE at www.seindia.com and the website of the BRLMs, i.e. ICICI Securities Limited, Axis Capital Limited, HSBC Securities and Capital Markets (India) Private Limited, J. P. Morgan India Private Limited and SBI Capital Markets Limited at www.icicisecurities.com, www.axiscapital.co.in, www.business.hsbc.co.in/en-gb/in/generic/ipo-open-offer-and-buyback, www.jpmipl.com and www.sbicaps.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see "Risk Factors" section of the DRHP and of the Red Herring Prospectus, when available. Potential investors should not rely on the DRHP filed with SEBI for making any investment decision.

These materials are not for publication or distribution, directly or indirectly, in or into the United States (including its territories and possessions, any state of the United States and the District of Columbia). These materials are not an offer of securities for sale into the United States, Canada or Japan. The securities referred to herein have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended, and may not be offered or sold in the United States, except pursuant to an applicable exemption from registration. No public offering of securities is being made in the United States. CONCEPT